https://archive.org/details/bk1479/page/n0/mode/1up

2010-09 -Satpanth Prakash (1479)

All Items on https://archive.org/details/realpatidar

Full Library on https://realpatidar.com/library

વર્ષ : ૧૭, અંક : ૧૧, સળંગ અંક : ૨૦૩ સપ્ટેમ્બર : ૨૦૧૦

સતપંથ પ્રકાશ









'ૐ પ્લાઝા હોલ' ઉદ્‌ઘાટન સમારોહ પ્રસંગે 'ૐ પ્લાઝા હોલ'નું આશીર્વાદ સહ
ઉદ્‌ઘાટન કરતા પ.પૂ. જગદ્‌ગુરુ શ્રી નાનકદાસજી મહારાજ તથા
પ.પૂ. યોગતપોનિષ્ઠ શ્રી પ્રેમદાસબાપુ તેમજ અન્ય મહાનુભાવો
(ભાવનગર - તારીખ : ૨૨-૮-૨૦૧૦)

મૂલ્ય : ૭/- રૂ.

https://archive.org/details/bk1479/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

Real Patidar
Unravel Truth

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v18.py

https://archive.org/details/bk1479/page/n2/mode/1up

2010-09 -Satpanth Prakash (1479)

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN,
o=realpatidar.com,
email=mail@realpatidar.com
Reason: I have reviewed this
document
Date: 2026.02.24 11:56:32 +05'30'

વર્ષ : ૧૭, અંક : ૧૧, સળંગ અંક : ૨૦૩ સપ્ટેમ્બર : ૨૦૧૦

સતપંથ પ્રકાશ









'ॐ પ્લાઝા હોલ' ઉદ્‌ઘાટન સમારોહ પ્રસંગે 'ॐ પ્લાઝા હોલ'નું આશીર્વાદ સહ
ઉદ્‌ઘાટન કરતા પ.પૂ. જગદ્‌ગુરુ શ્રી નાનકદાસજી મહારાજ તથા
પ.પૂ. યોગતપોનિષ્ઠ શ્રી પ્રેમદાસબાપુ તેમજ અન્ય મહાનુભાવો
(ભાવનગર - તારીખ : ૨૨-૮-૨૦૧૦)

મૂલ્ય : ૭/- રૂ.

realpatidar.com

સતપંથ જ્યોતના
સર્વ વાચક મિત્રોને
હાર્દિક શુભેચ્છા

જગદ્‌ગુરૂ સતપંથાચાર્ય
શ્રી નાનકદાસજી મહારાજના
શ્રી ચરણોમાં કોટી કોટી વંદન ....



RAJESHRI GROUP

102, KENT ESTATE
NARASING LANE
MALAD (WEST),
MUMBAI - 400 064.
TEL. : 863 2770/ 864 5597
FAX : 864 5598

realpatidar.com

https://archive.org/details/bk1479/page/n4/mode/1up

realpatidar.com

'ૐ પ્લાઝા હોલ' ઉદ્ઘાટન સમારોહ - ભાવનગર

તા. ૨૧,૨૨ - ઓગષ્ટ - ૨૦૧૦, શનિવાર - રવિવાર.



ઉપરોક્ત પ્રસંગે ભવ્ય સ્વાગત - શોભાયાત્રા



ઉપરોક્ત પ્રસંગે મંચસ્થ બિરાજમાન
પ.પૂ. જગદ્ગુરુ શ્રી નાનકદાસજી મહારાજ તથા પ.પૂ. યોગતપોનિષ્ઠ શ્રી પ્રેમદાસબાપુ



ઉપરોક્ત પ્રસંગે દીપ પ્રાગટ્ય કરતા પ.પૂ. જગદ્ગુરુ
શ્રી નાનકદાસજી મહારાજ તથા સંતો-મહાનુભાવો



ઉપરોક્ત પ્રસંગે વૈદિક મંત્રોચ્ચાર દ્વારા મહાપૂજા કરતા
પ.પૂ. જગદ્ગુરુ શ્રી નાનકદાસજી મહારાજ

realpatidar.com

realpatidar.com

'ૐ પ્લાઝા હોલ' ઉદ્‌ઘાટન સમારોહ - ભાવનગર

તા. ૨૧,૨૨ - ઓગષ્ટ - ૨૦૧૦, શનિવાર - રવિવાર.



ઉપરોક્ત પ્રસંગે આશીર્વચન પાઠવતા
પ.પૂ. યોગતપોનિષ્ઠ શ્રી પ્રેમદાસબાપુ (પંચવટી અમેરિકા)



ઉપરોક્ત પ્રસંગે આશીર્વચન પાઠવતા પ.પૂ. જગદ્‌ગુરુ
શ્રી નાનકદાસજી મહારાજ, પ્રેરણાપીઠ - પીરાણા.



ઉપરોક્ત પ્રસંગે એડવોકેટ શ્રી હર્ષદભાઈ અંધારિયાનું શાલ ઓઢાડી સન્માન કરતા
પ.પૂ. જગદ્‌ગુરુશ્રી નાનકદાસજી મહારાજ (જેમનો હોલ નિર્માણમાં વિશેષ સહયોગ રહ્યો હતો).



ઉપરોક્ત પ્રસંગે ધર્મસભામાં બિરાજમાન ભાવિક હરિભક્તો

realpatidar.com

https://archive.org/details/bk1479/page/n6/mode/1up

2010-09 -Satpanth Prakash (1479)

realpatidar.com

RNI No. GUJ-2006-11664
Postal Regd. No. Guj-GNR-238

સતપંથ પ્રકાશ

વર્ષ : ૧૭, અંક : ૧૧, સળંગ અંક : ૨૦૩

સપ્ટેમ્બર : ૨૦૧૦

સંપાદક

શ્રી શામજીભાઈ કે. પટેલ

સતપંથ પ્રકાશન સમિતિ

શામજીભાઈ કે. પટેલ	(વડાગામ)
છગનભાઈ એસ. પટેલ	(વડોદરા)
સુરેશભાઈ એસ. પટેલ	(ખેડબ્રહ્મા)
કેશુભાઈ ડી. પટેલ	(કરસનપુરા)
વિઠ્ઠલભાઈ એચ. પટેલ	(વડાગામ)
જસુભાઈ કે. પટેલ	(વિઠ્ઠલપુરા)
કેશુભાઈ એમ. પટેલ	(દુધાથલ)
હંસરાજભાઈ જી. પટેલ	(મેઘપુરા)
સુરેશભાઈ એમ. પટેલ	(અમદાવાદ)
બાબુભાઈ એસ. પટેલ	(મેઘકંપા)
શામજીભાઈ લધાભાઈ ધોળુ	(દુર્ગાપુર)
નિતેષકુમાર શામજીભાઈ છાભૈયા	(મોટી રાયણ)

સતપંથ પ્રકાશ - લવાજમ દર

	ભારતમાં	વિદેશમાં
વાર્ષિક	૮૦=૦૦	૭૦૦=૦૦
ત્રિવાર્ષિક	૨૨૦=૦૦	૧૮૦૦=૦૦
આજીવન	૭૫૦=૦૦	૪૦૦૦=૦૦
અમર	૧૫૦૦=૦૦	૭૦૦૦=૦૦

પ્રકાશક

સતપંથ પ્રકાશન સમિતિ

પ્રેરણાપીઠ પીરાણા, તા. દસક્રોઈ, જિ. અમદાવાદ - ૩૮૨૪૨૫.
ફોનઃ(૦૨૭૧૮) ૨૮૮૨૨૭,૨૮૮૨૨૯,૨૮૮૮૧૨ ફેક્સ : ૦૨૭૧૮-૨૮૮૮૭૨

Website :	E-mail :
www.satpanth.org	info@satpanth.org
www.satpanthprakashan.org	info@satpanthprakashan.org
www.nishklankinarayan.com	info@nishklankinarayan.com

મુદ્રક : સ્મૃતિ ઓફસેટ
જી/૧૨, ન્યુ માધુપુરા માર્કેટ, પોલીસ કમિશ્નરની ઓફિસ
સામે, શાહીબાગ, અમદાવાદ - ૩૮૦ ૦૦૪.
ફોન : (૦૭૯) ૨૫૬૨૪૩૬૦, ૩૨૯૫૫૪૨૩.

સંપાદકીય.....

પ્રેરણા

॥ ૐ શ્રી નિષ્કલંકી નારાયણાય વિજયેતેતરામ ॥

જે મનુષ્ય પોતાનું આચરણ શુધ્ધ બનાવે છે અને તે બીજાઓને પણ શુધ્ધ બનાવે છે, તેમનું આપણને સાનિષ્ય મળે કે જેથી મનની મલિનતા અને દુષ્ટ પાપ તેમજ કુસંસ્કારોનો નાશ થાય.

એક સળગતો દીપક લાખો ઓલવાઈ ગયેલા દીવાઓને પ્રગટાવી શકે છે, પરંતુ લાખો ઓલવાઈ ગયેલા દીપકો ભેગા થઈને એક દીપકને પણ પ્રગટાવી શકતા નથી. એક મહાજ્ઞાની પુરુષ જેનામાં જીવન-જ્યોતિ છે, તે લાખોને જીવન જ્યોતિ ભેટ આપી શકે છે, તેમને સન્માર્ગ પર લાવી શકે છે, તેમના જીવનમાં નવજ્યોતિ પ્રગટાવી શકે છે.

બીજાઓને જ્ઞાન આપતાં પહેલાં આપણે સ્વયં જ્ઞાની બનવું પડશે. બીજાઓને જ્ઞાનવાન અને સંસ્કારી બનાવતાં પહેલાં આપણે જ્ઞાનવાન અને સંસ્કારી બનવું પડશે. આચરણમાં સદ્‌ગુણો અને સંસ્કારોનો સમાવેશ કરીને શુધ્ધ, પવિત્ર અને સુગંધિત બનાવીને, આપણા જીવનને જ્ઞાન અને સંસ્કારની પ્રખરતાથી ઓત-પ્રોત કરી દઈએ. સેવા, સદાચાર, સુશીલતા અને સજ્જનતા દ્વારા સૂર્ય સમાન આપણી જાતને સ્વયં તેજસ્વી, વર્ચસ્વી અને ઓજસ્વી બનાવીએ. જેથી આપણા સંપર્કમાં આવવાથી સમાજમાં અનેકાનેક માણસ સંસ્કારી બની સન્માર્ગે ચાલવા લાગશે. તેમનામાં દુર્ગુણોનો નાશ અને સદ્‌ગુણોની વૃધ્ધિ થાય છે. આચરણમાં શુધ્ધતા, પવિત્રતા તથા ઉદારતાનો વિકાસ થાય છે.

સદ્‌ગુણી અને સંસ્કારી વ્યક્તિઓનો સંપર્ક ચારિત્ર્ય નિર્માણમાં મદદરૂપ થાય છે. જીવનથી જીવન પ્રકાશવાન થાય છે.

સંપાદક : શ્રી શામજીભાઈ કે. પટેલ

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com
Page 5 of 38

https://archive.org/details/bk1479/page/n7/mode/1up

2010-09 -Satpanth Prakash (1479)

realpatidar.com



પ્રાર્થના



જગતના કણ કણમાં, રજે રજમાં છુપાયો છે તું,
ઝંખતો તને અવિરત, પણ ક્યાંય દેખાતો ના તું,
હે નિષ્કલંકીનાથ ! તુજ દર્શન કાજ દિવ્ય નેત્ર દે' તું.

તને રિઝવવા ભજન નામનું, ધતીંગ કરતા સહું,
ધર્મના નામના ધતીંગમાં, ન ક્યાંય દેખાતો તું,
હે નારાયણ ! તુજ સ્મરણ કરવા નિર્મળ વાણી દે' તું.

કરસનદાસજીના પ્રેમરૂપી, હૃદયમાં સમાયો તું,
નાનકદાસજીને સદાય, આશીર્વાદ વરસાતો તું,
હે નાથ ! મારા હૃદયમાં પણ ભાવે બીરાજતો તું.

તને પામવા ખૂણે ખાંચરે, વન વગડે ભટકતો હું,
નિષ્કલંકી નામની લગની લગાડી, સતપંથીમાં વસ્યો તું,
હે નિષ્કલંકી નાથ ! સેવકને તારી ભક્તિરૂપી કમાણી દે' તું.

સંસાર સાગરની ભરતી ઓટમાં, અટવાતો હું,
મુજને ઉગારવા, નવજીવન થઈને આવ તું,
હે પ્રભુ ! મુજ અબુધને તારી મુક્તિ રૂપી ઉજાણી દે' તું.

●●●

બ્રિજેશ પટેલ ૯૯૭૪૬૬૪૨૪૪ ॥ ૐ શ્રી નિષ્કલંકી નારાયણાય નમઃ ॥ તરૂણ પટેલ ૯૦૯૯૧૧૬૯૯૯



સત્યમ્ ઓટો કન્સલટન્ટ

કાર વેચાણ, ખરીદ કમીશન એજન્ટ

૧૨, નાલંદા સોસાયટી, નારણપુરા રેલ્વે ક્રોસીંગ, નારણપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૧૩.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1479/page/n8/mode/1up

realpatidar.com

પાપકર્મ

પ.પૂ. જગદ્ગુરુશ્રી નાનકદાસજી મહારાજના સત્સંગ પ્રવચનમાંથી

મનુષ્ય અજ્ઞાનથી અંધ બનીને જીવનમાં ઘોર પાપકર્મ નિર્માણ કરે છે. અજ્ઞાની મનુષ્યને પાપ કરતી વખતે ખબર નથી કે હું શું કરી રહ્યો છું! પણ જ્યારે પાપકર્મ ઉદયમાં આવે છે ત્યારે મનુષ્ય એવી નિઃસહાય સ્થિતિમાં મૂકાઈ જતો હોય છે કે ગમે તેટલા પ્રયત્નો કરે પણ તે બહાર નીકળી શકતો નથી. પાપો કરવાં તે મનુષ્યનો સ્વભાવ નથી પણ વિભાવ છે. છતાં પણ મનુષ્ય પાપ કરે છે કારણ કે તે અજ્ઞાનથી અંધ બનેલો હોય છે.

હું જે કરું છું તે ક્રિયા કે કર્મ શું છે? કઈ રીતે કરૂં છું! તેનું અંતિમ પરિણામ શું આવશે? આ ત્રણ વિચારો કર્યા વગર કર્મો કર્યા કરે છે અને જીવનભર પાપકર્મો ચાલ્યા કરે છે. જો આ વિચાર કરતાં આવડી જાય તો માણસ જાત માટે પાપ ન કરવું શક્ય બની જાય.

રાગ દ્વેષાદિથી પ્રેરાઈને મનુષ્ય જે કાંઈપણ કરે છે તે પાપ જ હોય છે. આ પાપની પ્રવૃત્તિ પણ અનેક જીવોને દુઃખી બનાવીને થતી હોય છે. બીજા જીવોને દુઃખ આપ્યા વગર કે બીજા જીવોની હિંસા કર્યા વગર પાપની પ્રવૃત્તિ થવી શક્ય નથી. હવે વિચાર કરો કે આ રીતે કરાતાં પાપોનું પરિણામ શું આવે? રૌરવ નરક! રૌરવ નરકમાં જઈને જીવાત્માને ઘોર દુઃખો સહન કરવાં પડે છે. જો પરિણામનો વિચાર કરતાં આવડી જાય તો જીવનમાંથી પાપો વિદાય લીધા વગર રહે નહીં. મનુષ્ય પાપ કરે છે એ તો પાપ જ છે પણ તે પાપને પાપરૂપે સ્વીકારતો નથી એ તો મહાપાપ છે.

જીવનમાં થઈ રહેલાં પાપો અને તેના ફળનો વિચાર કરો. મનુષ્ય અજ્ઞાનવશ પાપને સાવ સામાન્ય માની બેસે છે. પણ જ્ઞાનીજનો કહે છે કે પાપને ક્યારેય સામાન્ય માનવાની ભૂલ કરતા નહિ.

સાપનો કણો નાનો હોય છે પણ તેનામાં જીવન ઝૂંટવી લેવાની તાકાત પડી હોય છે. બાકસમાં રહેલી એક જ દીવાસળીમાં પણ ભયાનક આગ લગાડવાની તાકાત સમાયેલી હોય છે. નાના સરખા બોંબમાં પણ વિનાશ નોંતરી દેવાની કાતિલ શક્તિ સમાયેલી હોય છે. તેમ નાનાં દેખાતાં પાપમાં પણ મનુષ્યની હોનારત સર્જી દેવાની તાકાત સમાયેલી છે. પાપને નાનું માનવું એ જ મહાપાપ છે. પાપને માફ કરાવવાના વિચારો નહીં પણ પાપને સાફ કરવાના વિચારો કરવા જોઈએ.

પાપ કરતી વખતે નાનું હોય છે પણ તેના ફળ મળે છે ત્યારે તે અનેકગણું થઈ ચુકેલું હોય છે. નાના બીજમાંથી વિરાટ વૃક્ષ પેદા થતું હોય છે, તેમ નાના પાપની સજા પણ બહુ મોટા સ્વરૂપે મળતી હોય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે પાપની સજા દશ ગણી, સો ગણી, હજાર ગણી, લાખ ગણી, કરોડ ગણી, કે ક્યારેક અનંતગણી મળતી હોય છે.

આવા પાપની સજા કેવી હોય તેનું એક દૃષ્ટાંત છે તે મનનપૂર્વક વિચારવા જેવું છે. એક ગોવાળ હતો. તે જંગલમાં ઢોર ચરાવતો હતો. ઢોર ચરતાં હતાં ત્યારે એક ઝાડના છાંયડે સમય પસાર

realpatidar.com

https://archive.org/details/bk1479/page/n9/mode/1up

2010-09 -Satpanth Prakash (1479)

realpatidar.com

કરતો હતો. તેવામાં તેને માથામાં ખૂબ ખંજવાળ ઉપડી. ખંજવાળતાં ખંજવાળતાં તેના માથામાંથી એક જૂ નીચે પડી. તેને જૂ ઉપર ખૂબ ગુસ્સો ચઢ્યો. 'એ જ મારુ લોહી પીવે છે' એ વિચારમાં ગુસ્સાથી પ્રેરાઈને તેણે એ જૂ ને બાજુમાં જ પડેલા એક બાવળના કાંટામાં પરોવી દીધી....!

જીવનની આ એક બહુ જ અધમ મનોવૃત્તિ છે કે પોતાના સુખ કે સ્વાર્થમાં જે આડું આવે તેને એ ક્યારેય સહન નથી કરી શકતો. એ એને અપરાધી લાગે છે અને એ અપરાધ બદલ એવા પામર જીવોનેય તે ગમે તેવી સજા કરવાની અજ્ઞાનતામાં અપેક્ષા રાખે છે.

જૂ માથામાં ચટકા ભરતી હતી. લોહી પીતી હતી. તેથી આ અજ્ઞાન ગોવાળે તેને કાંટામાં પરોવીને મારી નાખી પણ તેને એ ખ્યાલ ન આવ્યો કે આમાં પોતે કેવા પાપકર્મનું નિર્માણ કરે છે.

થઈ ગયેલા આ પાપકર્મનો અંજામ એ આવ્યો કે એ પછીના સાત ભવ સુધી દરેક ભવમાં તેને શૂળી ઉપર વિંધાઈ વિંધાઈને મરવાનું થયું. એક વખત જૂ ને વિંધવાથી સાત ભવ સુધી વિંધાવાનું દુ:ખ આવ્યું. કરાતાં પાપોની સજા કેવી ભયંકર હોય છે તે આ વાત ઉપરથી સમજવા જેવું છે. માટે જ્ઞાનીજનો મહાપુરુષો કહે છે કે પાપને કદી નાનું માનતા નહીં.

આપણા સતપંથ શાસ્ત્રમાં સદ્‌ગુરુશ્રી ઈમામશાહ મહારાજે પણ તેમની વાણીમાં કહ્યું છે કે :

"કર્મ તો સર્વ ઉતરે, ન ઉતરે પરનિંદાને આળ,
પરગમન ન ઉતરે, ન ઉતરે આપહત્યાને બાળ."
"આ પાંચ હત્યા પાપણી, લખી હોય જો લલાટ,
ફાટે પણ ફીટે નહીં, તેને ભોગવે છુટાય."

મનુષ્ય જીવનમાં જાણ્યે અજાણ્યે કોઈ અકર્મ કરે તો તેનું નિવારણ શક્ય છે. પણ પાંચ અકર્મો પરનિંદા, બીજા ઉપર આળ (આક્ષેપ) ચડાવવો તે, પરસ્ત્રીગમન કે પરપુરુષગમન, આપઘાત અને બાળહત્યા આ પાતકો એવાં છે કે તેનું નિવારણ શક્ય જ નથી અને એ પાંચ અકર્મ એ પાંચ પાપ જેના લલાટે લખાયાં હોય તો તેને ભોગવે જ છૂટકો છે.

પારકાની નિંદા જેવું કોઈ પાપ નથી. આજકાલ નવરા માણસોને ઓટલે કે બગીચામાં બેઠા બેઠા નિંદા કરવાની ટેવ હોય છે. સદ્‌ગુરુએ આપણને કહ્યું છે કે : **'જો કરશો અરીપરી વાત, તો નરકે પડે જીવ આપણા'**. નવરી જીભ મનુષ્યને પાપકર્મ કરાવે છે. તેને પરમાત્માના નામ સ્મરણમાં જોડી દો. "હરતાં ભજીયે ફરતાં ભજીયે, લ્યો પ્રભુનું નામ, જમ્યા પછી જીભલડીને શું છે બીજું કામ." ગમે તે કર્મ કરતાં જે સ્થિતિમાં હોઈએ એ સ્થિતિમાં ભગવાનનું નામ સ્મરણ ચાલુ જ રાખવું. મહાપુરુષોએ હાલતાં ચાલતાં નામસ્મરણ (ભક્તિ) કર્યાં છે. તેઓ આજે પૂજાય છે. કોઈ આપણી નિંદા કરે તો કરવા દેવી. ખેતરમાં ઘાસ ઉગે તો તેને નીંદવું પડે તેમ કોઈ નિંદા કરે તો આપણાં પાપ ધોવાશે. પણ નિંદા કરનાર તો પાપમાં પડશે જ.

કોઈ નિર્દોષ માણસ ઉપર ખોટા આક્ષેપ કરી આળ ચડાવવું તે પણ પાપ છે. ખોટાં આળ ચડાવવાથી સામેના માણસને કેટલું દુ:ખ થાય છે જગતમાં તેની બેઆબરૂ થાય, તેનો આત્મા કેટલો બધો કકળે છે અને વલોપાત કરે છે. તેના નિસાસા થકી આળ ચઢાવનારને હાની થાય છે. માટે જીવનમાં કદી કોઈના ઉપર ખોટું આળ ન ચઢાવવું.

પરગમનને સદ્‌ગુરુએ મહાપાપ કહ્યું છે. કોઈ પુરુષ પરસ્ત્રી સાથે ગમન કરે કે કોઈ સ્ત્રી પરપુરુષ સાથે ગમન કરે તો તેના જેવું કોઈ મહાપાપ નથી. અને તેની સજા પરમાત્મા ખૂબ કઠિન આપે છે.

ચોથું પાપ છે આપહત્યા - આપઘાત. આ

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com
Page 8 of 38

https://archive.org/details/bk1479/page/n10/mode/1up

પાપ પણ ઉતરતું નથી. મનુષ્ય પોતાના કર્મ પ્રમાણે આયુષ્ય લઈને આવે છે પણ અધૂરા આયુષ્યે જો મનુષ્ય આપઘાત કરે તો તેનો જીવ અવગતે જાય છે અને સાત ભવ સુધી તેને આપઘાત કરવો પડે છે. કદી કાળ ચડે, ક્રોધ આવે તો ગમ ખાવો પણ કદી આત્મહત્યા ન કરવી.

અને પાંચમું પાપ એ પણ મહાપાપ છે. જે કદી ઉતરતું જ નથી. તે છે બાળહત્યા. પહેલાંના સમયમાં રજવાડામાં જો દીકરી જન્મે તો તેને દૂધ પીતી કરી દેતા. દૂધ પીતી કરવું એટલે બાળકીના જન્મ સાથે તેને ગરમ ગરમ દૂધ પીવડાવવામાં આવતું ગરમ દૂધ પીવાથી દીકરીનું મૃત્યુ થઈ જતું અથવા દૂધ ભરેલી તપેલીમાં ઊંધે મસ્તક મોં ડૂબે તેમ લટકાવી રાખતા, બાળકી ગૂંગળાઈને મૃત્યુ પામતી. ઘણી જગાએ ખાટલાના પાયા નીચે બાળકીને દબાવી દેવામાં આવતી. આવી બાળહત્યાનું પરિણામ આપણે નજરોનજર નિહાળી રહ્યા છીએ કે વર્તમાન સમયમાં રજવાડાઓની હાલત કેવી છે.

ઓરમાન મા કે બાપ ક્યારેક નાનકડાં ફૂલ જેવાં બાળકોની હત્યા કરી નાખે છે, ક્યારેક ધનની લાલચ માટે કોઈ નીચ માણસ નિર્દોષ બાળકની હત્યા કરી નાખે છે. આ હત્યાનું પાપ કદી ઉતરતું નથી.

આજના સમયમાં સોનોગ્રાફી કરાવીને ગર્ભમાં દીકરી હોય તો તેની ભ્રૂણ હત્યા કરી દેવામાં આવે છે. દીકરીની હત્યા જેવું કોઈ પાપ નથી. દીકરી તો પુણ્યનો પ્યાલો છે, ત્યાગની મૂર્તિ છે. એવી ત્યાગની મૂર્તિની ભ્રૂણ હત્યા લોકો કરે છે તે ભગવાન કદી માફ નહીં કરે. સૌ સૌનું નસીબ લઈને આવે છે. દીકરીને દીધે કદી કોઈનું ઓછું થયું નથી અને થવાનું પણ નથી. જે મળે તે લઈને પરઘર દીકરી વિદાય થઈ જાય છે. દીકરી તો આપણું પરભવનું ઋણ લેવા આવે છે. દીકરી પ્રત્યે કદી ભેદભાવ રાખશો નહીં. નહીંતર કુદરતના ગુનેગાર થઈશું.

પરિવાર, પિતા અને પુત્રીના સંબંધો અદ્‌ભૂત અને નિઃસ્વાર્થ હોય છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં ગમે તેટલો મોટો રાજા દીકરીને સાસરે વળાવતો હોય કે, પછી ગામડામાં વસતો એક નાનો ગરીબ પિતા પોતાની દીકરીને સાસરે વળાવતો હોય તે સમયે બંનેની વેદના સરખી જ હોય છે.

પિતા ભલે આખા પરિવારનું ધ્યાન રાખતો હોય, પણ પિતાનું ધ્યાન તો પુત્રી જ રાખતી હોય છે. પુત્રીને પિતાનું જેટલું લાગે તેટલું કોઈને ન લાગે. આવી વહાલસોયી દીકરીને સાસરે વળાવતી વખતે પિતાને એમ થાય છે કે, કાલથી મારી કોણ સંભાળ રાખશે ? કાલથી મારું કોણ ધ્યાન રાખશે ? પિતાનો દીકરી માટે જે ભાવ છે, જે વાત્સલ્યછે તે જ પિતાને રડાવે છે. કયો પિતા દીકરીની વિદાય વેળા સ્વસ્થ રહી શકે ? ગમે તેવા નિષ્ઠુર કઠણ કાળજાના બાપની આંખોમાંથી આંસુડાંની ધારા તે વેળા વહેવા લાગે છે.

મિથિલા નગરીના જનક રાજા પણ સીતાજીની વિદાય વેળાએ ભાંગી પડે છે. પરમ વૈરાગી કહેવાતા તે મહાન પુરુષની જ્ઞાનની મર્યાદા પણ તે સમયે તૂટી જાય છે. રાજભવનના એક થંભને પકડીને મિથિલેશ તે દિવસે એક બાળકની જેમ રડી પડ્યા હતા.

આવો હોય છે એક બાપનો ત્યાગની મૂર્તિ જેવી દીકરી પ્રત્યેનો પ્રેમ. આવી પ્રેમાળ, હેતાળવી, વહાલસોયી, ત્યાગની મૂર્તિની ભ્રૂણહત્યા થાય, બાળહત્યા થાય, તેની ઉપેક્ષા થાય ત્યારે ભગવાન પણ કેમ માફ કરે. આવાં નિર્દોષ બાળકોની હત્યાનું પાપ કદી ઉતરતું નથી. સાત ભવ ભોગવવું પડે છે.

"તપ તીર્થ વ્રત યજ્ઞ કરો, દયો ભલે ભૂમિના દાન, તોય આવાં કર્મ ન ઉતરે, કરો ગંગામાં જઈ સ્નાન."

ઉપર દર્શાવેલાં પાપના નિવારણાર્થે તમે

realpatidar.com

https://archive.org/details/bk1479/page/n11/mode/1up

2010-09 -Satpanth Prakash (1479)

realpatidar.com

ગમે તેટલાં તપ કરો, તીર્થ કરો, યજ્ઞ કરો, ગંગામાં જઈ સ્નાન કરો કે પછી ધરતીનાં દાન આપો પણ આ પાપ, આ અકર્મ કદી ઉતરતાં જ નથી તેનાં ફળ ભોગવે જ છૂટકો છે.

જ્ઞાનીજનોએ આપણને પાપનાં ફળ સ્વરૂપે મળતાં દુ:ખદ અને દુર્ગતિનાં દર્શન કરાવી તેમાંથી મુક્તિ મેળવવાના પ્રયત્નો કર્યા છે, તે આપણને ડરાવવા માટે નહીં પણ ચેતવવા માટે છે. તેમ ધર્મનું ફળ સુખ કહ્યું છે એ આપણને લલચાવવા માટે નહીં પણ વાસ્તવિકતાનો ખ્યાલ આપવા માટે જ છે.

પાપના ફળનાં આવાં વર્ણન સાંભળતાં જ તમને પાપ છોડવાની લાગણી થવી જોઈએ. છોડાય તેટલાં પાપ છોડવા પ્રયત્ન કરો અને ન છૂટે તેવા પાપોનો પશ્ચાતાપ કરીને પાપને બાળવાનો પ્રયત્ન કરો. ભગવાને પાપના નાશ કરવાના ઉપાય બતાવ્યા છે. થયેલાં પાપો ગતગંગામાં સદ્‌ગુરુ સમક્ષ પ્રકાશિત કરો અને હૃદયપૂર્વક પ્રાયશ્ચિત કરો. ભારેમાં ભારે પાપકર્મોના નાશ માટે તીવ્ર તપશ્ચર્યા કરો. ભગવાનનું અખંડ નામસ્મરણ કરો. પરમાત્માની જરૂર તમારી ઉપર કૃપા થશે. તમારાં પાપ ક્ષીણ થઈ જશે. નાયો ભીલ સદ્‌ગુરુના શરણે ગયો. અગણીત પાપ કર્યા હતાં. સદ્‌ગુરુની કૃપાથી લૂંટારામાંથી સંત બની ગયો. ભગવદ્‌કૃપાથી વાલિયો લૂંટારો વાલિયામાંથી વાલ્મિકીઋષિ બની ગયો. જેસલ જાડેજાએ કેટલાંય પાપકર્મ કર્યા હતાં. પણ સતી તોરલના આશીર્વાદથી જેસલ પીર થઈ જગમાં પૂજાવા લાગ્યો. આપણે પણ પાપનું પ્રાયશ્ચિત કરવું જ રહ્યું. જેટલો દુ:ખોનો ભય અનુભવ્યો છે એટલો જ્યારે પાપનો ભય પેદા થશે ત્યારે મોક્ષ મળતાં વાર નહીં લાગે.

●●●

સદ્‌ગુરુ બ્રહ્માવાચા

નર નાથના ઘરની ખબર ન જાણી, સંસારમાં જીવ ભૂલ્યા રે,
પાંચ તત્વ કા મહેલ બનાયા, ત્રિગુણ કીધા પ્રકાશ રે,
સંસાર સાગરમાં મહાજળ ભરીયા, પ્રાણી તેના માંહે બુડો રે. નર.

નાભી કમળથી દમ ઉઠત હૈ, સ્મરણ શ્વાસ ઉશ્વાસ રે,
શીવ-શક્તિ કા મેળા કરના, બંકનાળ રસ પીના રે. નર.

બંક નાળનો માર્ગ વાંકો, ચઢે જો વીરલા કોય રે,
જેને સદ્‌ગોર પુરા મળીયા, સોહી ઘરમાં જાવે રે. નર.

ગંગા યમુના દો દશ વહેતી, વચમાં ભાગ સરસ્વતી કા,
ત્રિવેણી ઉપર સ્નાન કરના, સૂનમાં ધૂન લગાઈ રહે. નર.

ગગન મંડળમાં ગેબી ગુપત હૈ, અનહદ વાજાં વાગે રે,
ભ્રમર ગુફાના ઘાટ માંહે, અવિચળ વસ્તુ જડી રે. નર.

કહે ઈમામશાહ પ્રભુના પ્રતાપે, રહેણી દિવસ જાગો રે,
સ્વર્ગ ભુવનમાં તે નર જાશે, આવાગમન મટી જાશે રે. નર.

●●●

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1479/page/n12/mode/1up

realpatidar.com

સદ્‌ગુરુ વચનામૃત (ગોરવાણી)

સંકલન : હંસરાજભાઈ ગોવિંદભાઈ - મેઘપુરાકંપા

ખાવંદ ખોજી કાઢો, નહીં તો ફોગટ ફેરો ખાસો રે.
વાત વિચારીને વીરા મારા, તમને કહે કિરતારો.
જંબુદ્વિપમાં જાહેર બેઠા, જાણો મુનિવર વીરા રે.
લક્ષચોર્યાસી ફેરો મોટો, જાણો મુનિવર વીરા રે.
ફરતાં ફરતાં તખ્ત રચાયા, બ્રાહ્મણ ભણતા ભૂલ્યા રે.
વેદ પુરાણમાં જુઓ વિચારી, અમર ખોલો બારી રે.
જુગા જુગ તમે જુઓ વિચારી, ચંદ્ર ઉગ્યા ચવકારી રે.
આખર વેળામાં ઓળખી કાઢો, અમર ખોલો બારી રે.
ધરતી માતાને કોલ કર્યો તો, તે દિન હવે આવ્યો રે.

ઉપરોકત વાણીમાં સદ્‌ગુરુ શ્રી ઈમામશાહ મહારાજ સેવકોને કહે છે કે ખાવંદ ખોજી કાઢો નહીં તો ફોગટ ફેરો પડશે. એટલે કે જેમ સુહાગણ સ્રીને તેના જેવો પતિ મળે તો જીવન સંસાર સારો જાય. તેના કાર્યોને સિધ્ધિ મળે તેમ તમારા જન્મ મરણના ફેરાથી મુક્ત થવા સાચા પરમાત્માની શોધ કરીએ તો રસ્તો મળે અને જીવની મુક્તિ થાય. લક્ષ ચોરાસીના ફેરાથી મુક્ત થવા જાંબુ દ્વિપમાં જાહેર બેઠા છે તેને ઓળખી લ્યો. આ ચોર્યાસી લાખ યોનીઓનો ફેરો એટલો બધો ખતરનાક છે, એટલો બધો વસમો છે, એટલો બધો કષ્ટદાયક છે તે તેમાં પડ્યા પછી ખબર પડે છે. માટે આવા ચોર્યાસી લાખના ફેરાથી મુક્ત થવા જાહેરમાં હાજરમાં જે બેઠા છે જેને તખ્ત રચાયા છે, તેવા જાંબુદ્વિપના ધણીને આરાધો. તેની સંગત કરો તેનાં વચનોને આચરણમાં મુકી જીવની મુક્તિનો માર્ગ મોકળો કરો. બ્રાહ્મણ જેમ પાછલા વેદ પુરાણો - પાછલા થઈ ગયેલા અવતારો વેદ શાસ્રોને ભણીને તેનું જ્ઞાન લઈને ભૂલા પડ્યા છે તેને ભવિષ્યના અવતારનું જ્ઞાન થયું નથી તેથી તેઓ ભૂલા પડેલા છે. આગળ સદ્‌ગુરુશ્રી કહે છે કે તમે વેદ-પુરાણો જુઓ વિચારી. કેમ કે હવે પછી પરમાત્માનું કયું સ્વરૂપ - કયા સ્વરૂપે આવશે, કયા અવતાર ધારણ કરશે - કયો અવતાર ધારશે, તે વાતો વિચારી તેનું સાચું જ્ઞાન મેળવી ભવિષ્યના થનાર શ્રી નિષ્કલંકી નારાયણ અવતારને ઓળખી તેનું નિત્ય સ્મરણ કરી જીવની મુક્તિનો માર્ગ અપનાવીએ.

આખર વેળાએ પરમાત્માને ઓળખી કાઢો અને અમર ખોલો બારી એટલે સાકારરૂપે દશમા શ્રી નિષ્કલંકી નારાયણ અવતારનાં દર્શન થશે. તે જાંબુદ્વિપમાં પ્રગટ થશે તેને ઓળખી કાઢીએ તે થકી જન્મ મરણના ફેરાથી મુક્ત થઈએ. પ્રથમ મચ્છ અવતારમાં ભગવાન વિષ્ણુ શંખાસુર દાનવને મારવા પાછળ પડેલા ત્યારે શંખાસુર દાનવે ધરતીમાતાનું શરણું લીધું હતું. જેથી ધરતી માતાએ શંખવા દાનવને સંતાડેલ. પાછળ પાછળ વિષ્ણુ ભગવાન આવી શંખવા દાનવ વિષે પુછ્યું ત્યારે ધરતીમાતાએ કહ્યું; તમારો ચોર આપું પણ મને તમે વરો તો આપું. ત્યારે વિષ્ણુ ભગવાને વરદાન આપતાં કહ્યું કે હમણાં નહીં પરંતુ મારો દશમો નિષ્કલંકી અવતાર થશે ત્યારે આ વરદાન પૂર્ણ કરીશ. ત્યારે જે વચન વરવાનું કહેલું તે ધરતીમાતા આજદિન સુધી કુંવારા રહી કુંવારીકા ક્ષેત્ર પ્રેરણાપીઠમાં તે સ્થળ અત્યારે છે તે પૂજનિય સ્થળના હજારો યાત્રીકો દર્શન કરી ધન્ય બને છે લાભ લે છે. તે કુંવારીકા સ્થળે વિષ્ણુભગવાને ધરતીમાતાને આપેલ કોલ પૂર્ણ કરવા શ્રી નિષ્કલંકી સ્વરૂપે - સાકાર રૂપે આવી તે પૂર્ણ કરશે તે સમય નજીકના ભવિષ્યમાં આવી રહ્યો છે.

realpatidar.com

કળિયુગમાં સ્વામી પોતે પધાર્યા, ક્રિયા કરણી લાવ્યા રે.
હૃદયમાં પ્રભુજી બેઠા, પિત્તળ - પથ્થરને કાં પૂજો રે.
મારુ તારુ મેલી છાંડો, વાદ ન કરશો વીરા રે.
દસહી માસ ઉદરમાં રાખ્યો, કવલ કર્યો બહુ ભારી રે.
ગુન્હા હોય તો ગતમાં કહેજો, હાથ જોડીને રહેજો રે.
સમસેર સાથે સન્મુખ વાતો, જાણો મુનિવર વીરા રે.
જો તમે યહાં કરણી કમાઓ, તો વૈકુંઠ કરશો લીલા રે.
યે જ્ઞાન કહેત ઈમામશાહ, સાંભળો મુનિવર વીરા રે.

ઉપરના પદમાં સદ્‌ગુરુશ્રી કહે છે કે સાકાર રૂપે કળિયુગમાં પોતે આવશે. પણ નિરાકાર રૂપે તમારા હૃદયમાં ઘટમાં પ્રભુજી બેઠા છે તે તમારી સાથે છે, પાસે છે. "દૂર ન દેખો એ દિલમાં વશે" પરમ તત્ત્વ એ ચેતન રૂપે આ તમારી ઘટકાયામાં છે. તો આ અચેતન એવા પિત્તળ - કે પથ્થરના બનાવેલ બનાવટી દેવને પૂજીને શું કરશો ? તેમાં તમારૂં કલ્યાણ થશે નહીં તે તમારા જીવની મુક્તિ નહીં અપાવી શકે. વધુમાં સદ્‌ગુરુશ્રી કહે છે કે મારું - તારું મોહ-માયાને છોડી દો, કોઈની સાથે વાદ-વિવાદ ન કરશો અને જને તમને દસ માસ ઉદરમાં રાખી ભારે ઉપકાર કર્યો છે તેવાં તમારી માતાને કદી ભૂલશો નહીં. તમારાથી કોઈ ભૂલ થઈ હોય, કોઈ ખોટું કર્મ થયું હોય, કોઈ અપરાધ ગુના થયા હોય તો તે મંદિરમાં ગતગંગામાં હાથ જોડીને કહેશો તો તમારા બધા ગુનાહ અપરાધ માફ થઈ જશે. પરમાત્માને પ્રાર્થના દર-ગુજર કરી માફી માંગજો. તમારા ગુના માફ થઈ જશે. આ લોકમાં જ તમે સારી કરણી કરશો - સત્ય - ભક્તિ - નીતિ - ધર્મના માર્ગે ચાલશો તો તમારો વૈકુંઠમાં વાસ થશે એટલે કે તમારા જન્મ - મરણના ફેરાથી મુક્તિ મળશે. સદ્‌ગુરુશ્રીએ કહેલ આ જ્ઞાનને જીવનમાં ઉતારી તેના બતાવેલા માર્ગે ચાલશું તો જરૂર આપણા જીવનો ઉધ્ધાર થશે અને મહાદુઃખ એવા વારે વારે જન્મ-મરણના ચક્કર એવા લક્ષચોર્યાસીથી બચી જવાશે. ●●●

જીવન વિતાવશું રે સદા સત્સંગમાં..

- જીયલ નવીન ચૌધરી, દુર્ગાપુર - માંડવી

જીવન વિતાવશું રે સદા સત્સંગમાં,
હાં રે ગુણ સતપંથના ગાશું ગવરાવશું રે.. સદા..
નાવ અમારી ભવસાગરથી તારશું, માયાને મમતાની જાળથી ઉગારશું,
હાં રે પ્રીત અથર્વવેદમાં કરશું કરાવશું રે. સદા..
કામ ને ક્રોધ વળી દોષને નિવારશું, બ્રહ્મરૂપ બની નિષ્કલંકી અંતરમાં ધારશું,
હાં રે ધર્મ નિયમ પાળીને પળાવશું રે.... સદા..
પ્રેમે નિષ્કલંકીને મંદિરે પધરાવશું, દિલડાના દોષ અમે પીરાણા બુઝાવશું,
હાં રે ધ્યાન નિષ્કલંકીનું ધરશું ધરાવશું રે. સદા..
મહિમાની વાતો કરી વાસનાને બાળશું, અંતરના દોષ ટાળી ઈમામશાહ ગુરુને નિહાળશું,
હાં રે ન્યાય નીતિ રાખીને રખાવશું રે.. સદા..
જ્ઞાન જીવનનું શરણું સ્વીકારશું, સદ્‌ગુરુ શ્રી ઈમામશાહની વાત અંતરમાં ઉતારશું,
હાં રે સહેજે સંસાર અમે તરશું તરાવશું રે.. સદા..

●

realpatidar.com

https://archive.org/details/bk1479/page/n14/mode/1up

2010-09 -Satpanth Prakash (1479)



મન ચિંતામણીમાંથી

થોડા માંહે પ્રબોધ જ ઘણી,
નિંદા ના કીજે ભાઈ કોઈ જ તણી.
સર્વ સૃષ્ટિને પ્રણામ જ કરીએ,
સદ્‌ગુરુ વચન હૃદયમાં ધરીયે.
શુધ્ધ સમજણ હૃદયમાં રાખો,
ઘેલો થઈને કાં જેમ તેમ દાખો.
જેમ તેમ દાખે કોઈ અર્થ ના સરીયે,
કાચે કુંભે નીર ના ભરીયે.
શાસ્ત્ર ભણતાં ના આવે જ્ઞાન,
વળી વિશેષ આવે અભિમાન.
તું હી સાચા સાહેબ હો...
અભિમાન તજો મુનિવરો, સદ્‌ગુરુ પારસ પીછાણ.
હીરે હીરો વિંધીએ, તે પારસ કરી જાણ.

સદ્‌ગુરુશ્રીએ તેની આ અમૂલ્ય વાણીમાં થોડા વચનોમાં ઘણું ઘણું જ્ઞાન સમજાવ્યું છે. નિંદા ન કરવાની સલાહ આપતાં કહે છે કે : કોઈની પણ નિંદા ન કરશો. નિંદા કોઈની કરીને એનાં આપણે પાપ ધોઈએ છીએ અને આપણા ખાતે પાપનું પોટલું બાંધીએ છીએ. માટે કોઈનું સારુ ન થાય તો કાંઈ નહીં પણ પણ કોઈનું ખોટું ન કરીએ કોઈની નિંદા ન કરીએ. શિખામણમાં પણ કહ્યું છે કે **"કોઈ કેની ન કરશો નિંદા, જઈ ગતમાં કહો હે જંદા"** સદ્‌ગુરુશ્રીએ કહેલી વાણીને હૃદયમાં ધરીને સૃષ્ટિના સર્વ જીવાત્માને હૃદયમાં ભાવથી વંદીએ. પ્રેમથી ભાવથી નમસ્કાર કરીએ. સૌમાં આત્મારૂપે એક જ પરમાત્મા બીરાજમાન છે. જેથી આપણે જેવો ભાવ સામેની વ્યક્તિ તરફ કરશું તેવો જ તેના તરફથી આપણને પ્રતિભાવ મળશે. માટે આવી શુધ્ધ - સાચી સમજણ રાખી તે પ્રમાણે વર્તન કરીશું તો સર્વ પ્રત્યે આપણને આદરભાવ જાગશે. સદ્‌ગુરુશ્રી આગળ કહે છે કે ઘેલા થઈને એટલે કે ઉતાવળા થઈને ખોટો વિશ્વાસ રાખીને આ સંસારને સાચો માનીશું તો આપણું કાર્ય સફળ નહીં થાય. જેમ માટીના કાચા ઘડામાં પાણી ભરીએ તો ઘડો તૂર્ત જ ફુટી જાય છે તેમ ખોટામાં - ખોટા સંસારમાં પ્રીત રાખીશું તો અંતે પસ્તાવાનો વારો આવશે.

સદ્‌ગુરુશ્રી આગળ કહે છે કે : શાસ્ત્રો - વેદ - પુરાણો ભણતાં - તેનો અભ્યાસ કરતાં સાચું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. જીવની મુક્તિનું આત્મજ્ઞાન તો અંદરથી જ પ્રાપ્ત થાય છે. તેવા વેદ પુરાણાના અભ્યાસથી વળી પાછુ અભિમાન થાય છે કે હું આટલો પૂર્ણ છું. હું જ્ઞાની છું. મારા જેવો કોઈ નથી. આવા ખોટા અભિમાનથી પાછું પતન જ થાય છે. સદ્‌ગુરુશ્રીએ તેની વાણીમાં કહ્યું છે કે : "વેદ પઢી - પઢી અર્થ ન સીજે, જબ લગ અંતર ઘટ ન જાણ્યો"

હે પ્રભુજી! તમે જ સાચા સાંઈ છો, ભગવાન છો, પરમાત્મા છો. સદ્‌ગુરુ શ્રી આગળ કહે છે કે : અભિમાન તજો મુનિવરો. આ અભિમાનથી મનુષ્યનું પતન થાય છે. સત્ય વાત - સત્યવાણી તેને તેના અભિમાનથી નહીં સમજાય. માટે "અભિમાનને તજો પ્રભુને ભજો" હંમેશાં સદ્‌ગુરુશ્રીના આપણા ઉપર એટલા બધા ઉપકારો છે. આપણા જીવની મુક્તિ માટે તેઓ કેટલી ચિંતા કરતા હોય છે. આવા મુક્તિ દાતા - મુક્તિના માર્ગદર્શક સદ્‌ગુરુશ્રીને માન-પાનથી જોવું તેને પારસમણી જેવા કહ્યા છે કેમ કે તેની આપણને સંગત થવાથી તેના બોધ વચનોથી આપણા જીવની મુક્તિ થાય છે. માટે તેવા સદ્‌ગુરુશ્રીને કોટી-કોટી વંદન - નમન કરીએ. જેમ હીરે હીરો વિંધાય તેમ - દીવે દીવો પ્રગટે તેમ સદ્‌ગુરુની સંગતથી આપણી આત્મજ્યોત પ્રજ્વલે એ જ પ્રભુજીને પ્રાર્થના. ●

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com
Page 13 of 38

https://archive.org/details/bk1479/page/n15/mode/1up

realpatidar.com

સદ્‌ગુરુ વાણી

સત સોચો ભાઈ મુનિવરો, અને કાયે છોડો આપના આપ,
સતગુરુનાં વચન પાળીયે, તો જાયે જનમના પાપ.

હવે છેડે બાંધીને છોડી મનખો, અને દન રહ્યો પાછલી ઘડી ચાર,
સાંજ પડે વહેલા જઈ મળો, પાછે પડશે ઘોર અંધારી રાત.

રાત અંધારીને આંખે ના સંજે, અને ગીનાન દીપક ન આવે હાથ,
સતગુરુના વચને જે નહીં કરે, તે તો જાશે નરકની વાટ.

ગીનાન શોધીને વેદ ઓચરતા, અને ભણતા તે વેદ પુરાણ,
તે ડાહ્યા પંડિત ભૂલી ગયા, જેમ મેઘે દ્રીયો ભાણ.

તેણે છાંયડો લાગો પાપનો, અને રદે વસીયો કાલનો કાલ,
તેણે કમાઈ ખોઈ જુગ ચારની, તે તો પડશે નરકની ઝાલ.

નરકની ઝાલ છે બહુ દોહેલી, અને તમથી નહીં ખમાયે,
તે વીંછી માર્યો જેમ આંકડો, તેની આગને રહુ ના જાયે.

પૂર્વ ભાગ્ય વિના ન પામીયે, અને સતપંથ પદારથ સાર,
તેના એકોતેરસો વૈકુંઠમાં વધામણાં, તે તો કરશે સ્વામીનાં દર્શન.

ભાઈ વેલા પોતીને રત પવિત્ર, અને સવારી થઈ તૈયાર,
ઈહા ચેતી શકો તો ચેતજો, આગળ નથી અગીયારમો અવતાર.

હવે કૌલ સ્વામીનો પૂરો થયો, અને બોલાવી લેશે ભક્તના ભાવ,
અનંત કરોડી દેવ આગળ હોશે, ગુરુ ઈમામશાહ ઉતારે પરલે પાર.

જે સંસાર સાગર ઉતરી ઘેર આવશે, તેણે સ્વામી ઘણું કરી દેશે માન,
ઈહા પુરણ પુણ્ય કીધા મુનિવરો, જેણે દીધા મસ્તકનાં દાન.

કહેત ઈમામશાહ સુણો મુનિવરો, ઈહા પહેલા પૂજા થકી ફલ પામો
અંતે છેલ્લી વેલા સંઘે તોલશે, પછે અબદા અબદી અમરાપુરી જાવો.

●●●

realpatidar.com

https://archive.org/details/bk1479/page/n16/mode/1up

2010-09 -Satpanth Prakash (1479)

realpatidar.com

બ્રહ્મ નિર્ગુણ છે માટે જ નિરાકાર છે

- પ.પૂ. મહંતશ્રી શીવરામદાસજી મહારાજ
(શ્રી નાયાકાકા મહારાજ સંસ્થાન - કુકસ)

માયાના ત્રણ ગુણો - સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ પૈકીનો એક પણ ગુણ જેનામાં નથી તે શુધ્ધ બ્રહ્મ કહેવાય. માયાનો કોઈપણ ગુણ શુધ્ધ બ્રહ્મમાં ભળે નહીં, ત્યાં સુધી તે નિરાકાર જ રહે, સાકાર થાય જ નહીં. નિર્ગુણ બ્રહ્મનો આકાર હોય જ નહીં તે નિરાકાર જ હોય. શુધ્ધ નિર્ગુણ બ્રહ્મને નિરાકારમાંથી સાકાર થવું હોય તો તેને માયાના ગુણનો સ્વીકાર કરવો પડે. શુધ્ધ બ્રહ્મમાં માયાના ગુણો ભળે ત્યારે જ નિર્ગુણ નિરાકાર બ્રહ્મ સગુણ સાકાર બ્રહ્મ બને.

દા.ત. શુધ્ધ સો ટચનું સોનું હોય તેનો કોઈ દિવસ ઘાટ બને નહીં. શુદ્ધ સો ટચની સોનાની લગડી હોય તેની વીંટી, બંગડીઓ, કંઠી વગેરે ઘાટ આકાર બનાવવા હોય તો તે ના બની શકે. શુદ્ધ સોનાના ઘાટના આકાર બનાવવા હોય તો તે સો ટચની લગડીમાં ત્રણ વાલ તાંબુ ઉમેરવું પડે. શુદ્ધ સોનામાં જ્યાં સુધી તાંબુ ભેળવો નહીં અને શુદ્ધ સોનું ત્રણ વાલ ફેર થાય નહીં ત્યાં સુધી તેની બંગડીઓ, વીંટી, કંઠી વગેરેનો કોઈ પણ ઘાટ કે આકાર થઈ શકે નહીં.

એવી જ રીતે શુદ્ધ બ્રહ્મ જ્યાં સુધી નિર્ગુણ (માયાના ગુણ રહિત) રહે ત્યાં સુધી તે નિરાકાર જ રહે, સાકાર બને નહીં. પરંતુ જ્યારે શુદ્ધ બ્રહ્મમાં માયાના ત્રણ ગુણો ભળે અને નિર્ગુણ બ્રહ્મ સગુણ (માયાના ગુણો સહિત) બ્રહ્મ બને ત્યારે સાકાર બ્રહ્મ બને.

પાણી નિરાકાર છે. તેનો પોતાનો કોઈ આકાર નથી. પાણી જે વાસણમાં ભરીએ તે વાસણનો આકાર તે પકડે છે. ઘડામાં રેડો તો ઘડાનો આકાર અને લોટામાં રેડો તો લોટાનો આકાર પકડે છે. પાણી સ્વયં પોતે નિરાકાર છે. તેથી જ તે દરેક વાસણનો પાત્રનો આકાર પકડી શકે છે. પરંતુ આ પાણીમાં તીવ્ર ઠંડી પ્રવેશ કરે તો તે પાણી બરફ થઈ જાય અને નિરાકાર પાણી સાકાર બરફ બની જાય. પાણીમાં તીવ્ર ઠંડીનો ગુણ પ્રવેશ થતાં તે સગુણ સાકાર (ઘન) બરફ બને જે બરફની લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ, જાડાઈ વગેરે હોઈ શકે પરંતુ વાસ્તવમાં તો પાણી અને બરફ બંને એક જ વસ્તુ છે. પાણી અને બરફ તે બે તત્ત્વો કરીને જુદાં નથી એક જ છે.

પાણી એટલે દ્રવીભૂત થયેલો બરફ અને બરફ એટલે ઘનીભૂત થયેલું પાણી. એવી જ રીતે નિર્ગુણ બ્રહ્મ અને સગુણ બેય જુદા જુદા તત્ત્વ નથી પરંતુ એક જ તત્ત્વના બે નામ છે. નિર્ગુણ બ્રહ્મમાં માયાના ગુણો પ્રગટ થતાં તે સગુણ કહેવાય છે. બ્રહ્મ નિરાકાર છે અને સાકાર પણ છે. આ બધા આકાર પરમાત્મા જ છે. પરમાત્માનો પોતાનો કોઈ આકાર નથી. તમે પરમાત્માનો આકાર શોધો છો તેથી તમને સવાલ ઊઠે છે કે પરમાત્મા સાકાર કેમ નથી ?

વૃક્ષમાં પરમાત્મા જ વૃક્ષ છે. પક્ષીમાં પરમાત્મા જ પક્ષી છે. ઝરણામાં પરમાત્મા જ ઝરણું છે. માણસમાં પરમાત્મા જ માણસ છે. પથ્થરમાં પરમાત્મા જ પથ્થર છે. ફૂલમાં પરમાત્મા જ ફૂલ છે. આમ તમામમાં પરમાત્માનું જ (બ્રહ્મનું જ) ચૈતન્ય રેલાયેલું છે. આ ચૈતન્ય ના હોય તો વૃક્ષ ઠુંઠું પણ ના રહે, ફૂલ કરમાઈ જાય, ઝરણું સુકાઈ જાય, પક્ષી, માણસ મડદું થઈ જાય.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1479/page/n17/mode/1up

realpatidar.com

તમે પરમાત્માનો આકાર શોધતા રહેશો તો ભૂલા પડશો. બધા આકાર જેના છે તેનો પોતાનો કોઈ આકાર ના હોઈ શકે. બધા આકાર જેના છે તે સ્વયં નિરાકાર જ હોઈ શકે.

બધાં નામ જેનાં છે તેનું પોતાનું નામ કેવી રીતે હોઈ શકે ? જેનું પોતાનું એક નામ હોય તેનાં બધા નામ (સહસ્ત્ર નામ)ના હોઈ શકે. બધા રૂપોમાં જે ઝળકે છે, તેનું પોતાનું રૂપ ના હોઈ શકે. જે બધી જગ્યાએ છે તેને તમે એક જ જગ્યાએ શોધવાની કોશિશ કરશો એ તો ભૂલા પડશો.

જો પરમાત્મા (બ્રહ્મ) અમુક એક જ જગ્યાએ હોય તો તે બધી જગ્યાએ કેવી રીતે હોઈ શકે ? એક જ જગ્યાએ પરમાત્મા હોય તો તે સીમિત બની જાય. પરમાત્મા તો અસીમ છે. તેની કોઈ સીમા નથી. તેનો કોઈ આદિ નથી અંત નથી તો તેનું મધ્ય ક્યાંથી જડે ? તેની કોઈ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, જાડાઈ, પાતળાઈ નથી.

એટલે બ્રહ્મ (પરમાત્મા) કોઈ વ્યક્તિ નથી પરંતુ અનુભૂતિ છે. પરમાત્મા તો બધાની અંદર વહેતી જીવનની ધારા છે. વૃક્ષ છુપાયેલાં બીજમાંથી પ્રગટ થઈ રહ્યું છે. તે પ્રગટ થવું પરમાત્મા છે. પરમાત્મા એવા નથી જેવો પથ્થર છે. પરમાત્મા એવા નથી જેવા તમે છો. પરમાત્મા એવા નથી જેવા ચંદ્ર, તારા છે અને જો પરમાત્મા તમારા જેવા હોય, પુરુષ જેવા હોય તો પછી સ્ત્રીમાં કોણ હોય ? સ્ત્રી જેવા હોય તો પછી પુરુષમાં કોણ હોય ? મનુષ્ય જેવા હોય તો પછી પશુઓમાં, પક્ષીઓમાં કોણ હોય ?

નિર્ગુણનો અર્થ એવો નથી કે પરમાત્મામાં કોઈ ગુણ નથી. નિર્ગુણ એટલે તમામ ગુણ તેના જ છે. એટલા માટે તેનો કોઈ વિશેષ ગુણ ના હોઈ શકે.

●●●

શ્રધ્ધા

- શામજીભાઈ લાલજીભાઈ પોકાર. ઉતુકુલી (તામિલનાડુ)

'શ્રધ્ધા' એટલે વિશ્વાસ. વિશ્વાસ એટલે ધીરજ. આજના કલિયુગમાં શ્રધ્ધા રાખવી ધીરજ રાખવી એ બહુ જ મુશ્કેલનું કામ છે. આપણા વડીલો સંતો આપણને એક જ વાત સમજાવે છે કે તમે તમારા ઉપર, દરેક કામ ઉપર અને પ્રભુ પ્રત્યે શ્રધ્ધા રાખશો તો તમે જરૂર પાર ઉતરી જશો.

આજના કલિયુગમાં માણસને દરેક કામ દરેક ઈચ્છા ટૂંક સમયમાં પૂર્ણ થવી જોઈએ અગર ટૂંક સમયમાં પૂર્ણ ન થાય તો તે પ્રભુ પ્રત્યે જે શ્રધ્ધા છે તે શ્રધ્ધા ઉઠાવી લે છે અને અંતે નિરાશાને પામે છે.

સમુદ્રમાં વહાણોમાં માછીમારો જાય છે તેમને ખબર છે કે કોઈપણ સમયે દરિયામાં તોફાન આવી શકે છે. અમારા જાન જોખમમાં છે, છતાં પણ પોતાની જીંદગી પ્રભુને સોંપી પ્રભુ પર શ્રધ્ધા રાખી જોખમ ખેડે છે. આમ શ્રધ્ધા એ મોટી વાત છે. અને શ્રધ્ધાર્થી અંતે મોક્ષને પામે છે.

એક ખેતરમાં વૃધ્ધ ખેડૂત કૂવા પર બળદથી કોશ ચલાવી રહ્યા હતા. જ્યારે પાણી બહાર આવે ત્યારે કોશ પકડવામાં વૃધ્ધ ખેડૂતબાપાને તકલીફ પડતી હતી અને ઓ 'બાપરે' કહ્યા કરતા હતા. તેવામાં તે જગ્યાએથી એક સંત પસાર થયા. વૃધ્ધ ખેડૂતબાપાનો અવાજ સાંભળી સંતે ખેડૂતબાપાને કહ્યું કે તમો આ બાપરે કહ્યા વગર લક્ષ્મીપતિને યાદ કરો તો તમો ભવ સાગર તરી જશો. ભોળા વૃધ્ધ ખેડૂતબાપાએ તો લક્ષ્મીપતિ.. લક્ષ્મીપતિ કહેતાં કહેતાં કામ ચાલું રાખ્યું. થોડા સમયમાં ખેડૂતબાપા લક્ષ્મીપતિ કહેવાને બદલે લપસીપડ લપસીપડ બોલવાનું ચાલુ રાખ્યું. લક્ષ્મીપતિ ભુલાઈ ગયું છતાં અંતરની ભાવના હતી કે લપસી પડ કહેવાથી મને ભગવાન મળશે અને મોક્ષ મળશે. તો આ શ્રધ્ધાથી ભગવાન ખુશ થયા અને વૃધ્ધ ખેડૂત બાપાને દર્શન આપ્યાં. આમ દરેક કામ મનુષ્યે સદ્‌ગુરુની વાણી પર શ્રધ્ધા રાખી સદ્‌ગુરુની શિખામણનું શ્રધ્ધાથી પાલન કરશું તો જરૂર ભવસાગર તરી જઈશું. ●●●

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1479/page/n18/mode/1up

2010-09 -Satpanth Prakash (1479)

realpatidar.com

ન હીન જન્મે કરી હીન માનવ *(કર્ણની નિષ્ઠા)*

- ભીખુભાઈ પત્રકાર, જેતલપુર.

શ્રી કૃષ્ણ મહાભારતનું યુધ્ધ નિવારવા કૃતનિશ્ચય હતા. હસ્તિનાપુરની રાજસભામાં કુરુકુળના વડીલો અને આચાર્યોની હાજરીમાં દુર્યોધન અને ધૃતરાષ્ટ્રને આ મહાસંહારથી સહુને બચાવવા પૂરા દીલથી પ્રમાણિક પ્રયાસ કર્યો પણ દૂર્યોધનના ઘમંડ અને ધૃતરાષ્ટ્રની અનિર્ણાયકતાના કારણે એમનો સાચા દીલનો પ્રયાસ પણ નિષ્ફળ ગયો.

પાંચ પાંડવો માટે માત્ર પાંચ ગામની માંગણી તો દુર્યોધને ઠુકરાવી દીધી એટલું જ નહિ "સોંયની અણી જેટલી જગ્યા પણ નહિ આપુ" એમ એવું નફટાઈપૂર્વક જાહેર કર્યું. ત્યારે કૃષ્ણને લાગ્યું કે હવે કૌરવોને સમજાવવા એ ભીંતે માથું પછાડવા જેવું છે.

"પાર્થને કહો ચઢાવે બાણ, હવે તો યુધ્ધ એજ કલ્યાણ" એવી પંક્તિમાં આપણા કવિ શ્રી નાનાલાલે કૃષ્ણના મનોભાવને વાચા આપી છે.

આમ અત્યંત વિષમ સ્થિતિ હોવા છતાં અને યુધ્ધ અનિવાર્ય જણાતું હતું છતાં શ્રીકૃષ્ણ એક મુત્સદ્દી રાજનીતિજ્ઞ છે. કાર્યસિધ્ધિના ચાર ઉપાયો પૈકી સામ સમજાવટનો માર્ગ તો નિષ્ફળ ગયો. પણ દામ અને ભેદ અને છેવટે દંડનો માર્ગ તો હજુ અજમાવવાનો બાકી હતો.

આપણા દેશમાં સાધન શુધ્ધિ કે સાધ્ય સિધ્ધિની ચર્ચા પરાપૂર્વથી ચાલતી આવી છે. ચાણક્ય જેવા નિપુણ રાજનીતિજ્ઞો ઉઘાડે છોગ પુરસ્કાર કરતા. સાધ્ય શુધ્ધ હોય તો કોઈપણ સાધન અજમાવતાં અચકાવું નહિ એમ કહીને વ્યવહાર અને નૈતિકતાના વ્યાજબી સમન્વયનું સમર્થન કરતા પણ અનેક ચિંતકો થયા. પૂજ્ય મહાત્મા ગાંધીજીએ સાધનશુધ્ધિ વિના સારુ સાધ્ય શક્ય જ નથી એમ પણ જણાવ્યું. પણ શ્રીકૃષ્ણની ધર્મ વિભાવના વધારે સુક્ષ્મ અને ઉચ્ચસ્તરીય હતી. શ્રી કૃષ્ણની ભૂમિકા ચારિત્ર્ય પ્રધાન હતી.

તમારો પોતાનો ધર્મ અને સમષ્ટિનો ધર્મ એટલે કે સનાતન ધર્મમાં ટકરાવ ઉભો થાય ત્યારે એમણે બૃહદ ધર્મ મોટો ધર્મ સચવાવો જોઈએ એની હંમેશાં હિમાયત કરી. શ્રીકૃષ્ણના જીવન વ્યવહારને સમજવો હોય તો એમનું આ જીવનસૂત્ર પ્રત્યેક માનવીએ હૈયે કોતરી રાખવા જેવું છે અને તે છે यद भूतहित्तम् अत्यन्तं तत् हिं सत्यं मतं मम । જેમાં પ્રાણીઓનું વ્યાપક હિત સમાયેલું હોય એને જ હું તો સત્ય માનું છું.

આ બૃહદધર્મની મર્યાદામાં રહી એમણે શઠ સામે શઠતાનું સમર્થન કર્યું કાંટાથી કાંટો કાઢવાની કે ઝેરનું મારણ ઝેર જે હોય એવી બિલકુલ વાસ્તવવાદી રાજનીતિ અજમાવતાં એમને ક્યારેય સંકોચ થયો નથી.

સમજાવટના પ્રાધાન્યવાળી પોતાની મર્મભેદી વાણીથી દુર્યોધન સમજ્યો નથી. કુરુકુળની રાજસભામાં ઉપસ્થિત ત્રણ યુગમુનિઓ પરશુરામ, કણ્વ અને નારદની સદૃષ્ટાંત શિખામણને પણ એણે ગણકારી નથી. દાસભાવ અનુભવતા સભાસદો પણ ભયભીત હોઈ કશુ બોલી શક્યા નહિ. છેવટે દ્રતને પકડવા જેવી નિતાન્ત ધર્મવિરોધી ચેષ્ટા સામે પોતાનું વિરાટ વિભુત્વ પ્રગટ કર્યું, તો પણ દુર્યોધન સમજ્યો નહિ ત્યારે શ્રીકૃષ્ણે ભારે હૈયે વિદાય લીધી.

ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય, વિદુર, ધૃતરાષ્ટ્ર, અશ્વત્થામા અને વિકર્ણ જેવા સહુ અબાલવૃધ્ધો કૃષ્ણને વિદાય આપવા ગયા. પરંતુ કૃષ્ણ સહિત કોઈ

realpatidar.com

https://archive.org/details/bk1479/page/n19/mode/1up

realpatidar.com

આગામી મહાસંહારને ખાળી શક્યા નહિ.

પ્રજ્ઞાવાન શ્રીકૃષ્ણને એટલું તો સમજાઈ ગયું હતું કે દુર્યોધન કર્ણરૂપી ખીલાના જોરે કૂદી રહ્યો છે. જો કર્ણ દુર્યોધનનો સાથ છોડી દે તો સંભવ છે કે દુર્યોધન યુધ્ધનો ઉદ્યમ જ માંડી વાળે.

નગર બહાર જઈ કૃષ્ણ કર્ણને પોતાના રથમાં બેસાડી દામ અને ભેદના પાસા ફેંકે છે. સર્વ પ્રથમ તો કર્ણની ધર્મપ્રીતિની વાત કરી એની પીઠ થાબડે છે અને કર્ણ સૂતપુત્ર નથી પણ કુંતીપુત્ર છે એ રહસ્ય જણાવે છે. સાથે સાથે જો કર્ણ પાંડવપક્ષે આવે તો એ સહુથી મોટો હોવાથી એને રાજા બનાવવાનું જ નહિ પણ દ્રૌપદી પણ એનો પતિ તરીકે સ્વીકાર કરશે એવી હૈયાધારણ આપે છે.

કર્ણ સામે જબરદસ્ત પ્રલોભનો મુકાય છે અને વળી એ મુકનારા બીજા કોઈ નહિ પણ યુગપુરુષ શ્રીકૃષ્ણ છે. ઈન્દ્રપ્રસ્થનું આધિપત્ય સર્વાંગે સુંદર દ્રૌપદીનું પતિપદ અને કૃષ્ણની કાયમી મૈત્રી કોઈપણ વ્યક્તિ આવાં પ્રલોભનોથી વિચલિત થઈ જાય, પણ કર્ણ આપણા મૂલ્યહીન રાજકારણી જેવો પાટલીબદલુ નથી. કર્ણનું પાત્ર પણ એક વિશિષ્ટ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવે છે. એની વિચારસરણી સ્પષ્ટ છે. જે મિત્રની તરફદારીને કારણે તે સમાજમાં અંગદેશના રાજા તરીકે પ્રતિષ્ઠિત થયો. જેને લીધે સૂતપુત્રના અપવાદ વચ્ચે એને સમાજમાં માન અને અકરામ મળ્યા એ મિત્રનો તે દ્રોહ કરવા માગતો નથી.

મિત્રતાનું મૂલ્ય એ સારી રીતે જાણે છે. એટલું જ નહિ એ જે સામાજિક યંત્રણામાં મોટો થયો. પોતાના કથિત હીન જન્મને કારણે ચારે બાજુથી હડધૂત થયો તે દલિત અવસ્થાનું વૈષમ્ય એ ભૂલવા તૈયાર નથી આ વાત તેના મનમાં ડંખ્યા કરે છે.

આપણે ત્યાં કવિવર રવિન્દ્રનાથ ટાગોર, ઉમાશંકર જોષી, અને સંદરમ્ જેવા કવિઓને અન્યાયનો ભોગ બનેલા કર્ણની નીતિમત્તા અને ખુમારીભરી વ્યક્તિમત્તાએ આકર્ષ્યા છે. આ નોંધપાત્ર ઘટના છે. શ્રી ઉમાશંકરભાઈએ "પ્રાચીના" નામના એમના કાવ્ય સંગ્રહમાં કર્ણનો કર્ણ અને કૃષ્ણ વચ્ચેનો મનોરમ સંવાદ કાવ્યાત્મક વાણીમાં પ્રગટ કર્યો છે.

કૃષ્ણ કહે છે; દુર્યોધન તો સ્વાર્થી છે. એને તો રાજ્યલોભ છે પણ કર્ણ તું તો ધર્મપ્રિય અને વળી દાનપ્રિય છે. તું આ લડાઈ શા માટે લડે છે ? ત્યારે જવાબ આપતા કર્ણ કહે છે; સમષ્ટિના સત્યનું હુંય રશ્મિ, હું પણ એક સામાજિક સત્ય માટે લડું છું કે :

"ન હીન જન્મે કરી હીન માનવ,
ન હીન કર્મે કરી હીન માનવ"

ને આથી જ "સ્વયંવરે જીવન સુંદરીના ન જન્મ જોવાય પરંતુ પૌરુષ" કર્ણ કહે છે કે હું આ સિધ્ધાંતના પ્રસ્થાન માટે લડું છું અને લડતો રહીશ.

કર્ણના આ અભિગમને મોટાભાગના વિવેચકોએ પ્રશંસ્યો છે. શ્રી હરિન્દ્ર દવે લખે છે. "મૈત્ર સંબંધોની દષ્ટિએ કર્ણને તપાસવો સૌથી સંગત છે. જાણીતા અંગ્રેજ સર્જક ઈ. એમ. ફોર્સ્ટરે એક વાર કહ્યું હતું કે, મારે મારા દેશનો કે મારા મિત્રોનો દ્રોહ કરવામાંથી પસંદગી કરવાની આવે તો ભગવાન મને દેશનો દ્રોહ કરવાનું બળ આપે. કર્ણના જીવનમાં આ પસંદગી આવી હતી અને તેણે દુર્યોધન જેવા મિત્રનો દ્રોહ કરવા કરતાં દેશના દ્રોહને વધુ પસંદ કર્યો હતો. તેથી શ્રીકૃષ્ણે આપેલા પ્રલોભનો તેને ઠુકરાવી દીધાં.

પોતાના જીવનરક્ષક એવા કવચ અને કુંડળ હસતે મોઢે દાનમાં આપી તેની દાનપ્રિયતા સાબિત કરી આપી હતી. કર્ણ પૂર્વગ્રહમાં પોતાના મિત્રને બચાવી શકશે એવું વિચારી શક્યો નહિ. એમ સમજાવતા સંસ્કૃતિચિંતક દર્શક કહે છે શરીર પરથી કવચ કુંડળ ઉતારી દેવા સહેલાં છે પરંતુ

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1479/page/n20/mode/1up

2010-09 -Satpanth Prakash (1479)

realpatidar.com

સામાજિક, માન્યતાના પ્રતિષ્ઠાના કે પ્રણાલીના ભ્રમપૂર્ણ કવચ કુંડળ ઉતરડવાં દુષ્કર - અતિદુષ્કર છે.

મહાભારતના આવા સુંદર ઉત્કૃષ્ટ પ્રસંગોમાંથી નીતરતાં જીવન રહસ્યો જાણવાં જરૂરી છે. આવી મુશ્કેલીઓમાંથી શ્રીકૃષ્ણ જેવા અવતારી પુરુષો પણ બાકી રહ્યા નથી ત્યારે માનવજીવનની તમામ સમસ્યાઓનું સમાધાન આપને મહાભારતમાંથી મળે છે.

કર્ણના જેવું નીતિમતાવાળુ જીવન જીવનારા લોકો આ કલિયુગમાં શોધ્યા જડતા નથી. સ્વાર્થ ગંદી ખટપટોથી દૂર રહેવા માટે આપણા સંપ્રદાયના સંત મહાન પુરુષો રાહ બતાવી રહ્યા છે તેથી મહાભારતના મહાન ગ્રંથમાં જીવનદર્શન થાય છે. જન્મથી કાંઈ ખરાબ હોતું નથી. સમય સંજોગો માણસોને ઘડે છે. બે પિતરાઈ પરિવારોની સંઘર્ષ કથામાં એક પરિવાર સત્ય-ન્યાય અને ધર્મના રક્ષણ માટે જીવે છે. જ્યારે બીજો પરિવાર અધર્મના માર્ગે આગળ વધી હલકટ ભરી ચેષ્ટાઓ કરે છે. આખરે વિજય તો ધર્મનો જ થાય છે. અવતારી શ્રીકૃષ્ણે ધર્મના રક્ષણ માટે પ્રપંચનો સહારો લીધો હતો. આ મહાભારતની કથા વાસ્તવમાં કયા માર્ગે જવું તેનો અંગૂલિનિર્દેશ કરે છે.

આજના કલિયુગમાં ઠેર ઠેર દુર્યોધન અને મહાત્વાકાંક્ષી એવા ધૃતરાષ્ટ્ર જોવા મળે છે. સારુ ગ્રહણ કરીને નકામું ત્યજી દઈશું તો સંત પુરુષો, જગદ્ગુરુ, મહામંડલેશ્વરોના રાહ ઉપર ચાલીશું તો જીવન સરળ અને હેતુલક્ષી બની રહેશે. કલિયુગનો પ્રભાવ ઘટશે અને અંત આવશે.

●●●

જીવ્યું લેખે લાગ્યું

- નારણભાઈ ડી. પટેલ, લાલુકંપા.

સંતોની દુનિયાને દેશ-પરદેશ કે સીમ-સીમાડાની કેદ હોતી નથી. ભગવાનના કે ભગવાનના ભક્તોના ગુણ ગાતાં સ્થળ-કાળ જુએ કે થાકે - કંટાળે એ ભક્ત શેનો ? એ વ્યવસાયમાં વીતે તેટલો વખત જ લેખે, બીજો બધો અલેખે. એ એક જ હિસાબ સાચો છે. બીજી બધી આળપંપાળ છે.

એક સત્સંગીના મોઢે સાંભળેલી આ વાત છે : એક ગામે કોઈ નવું ખેડૂત કુટુંબ વસવાટના ઈરાદે હળ-ઓજાર, ઘરવખરી લઈને આવ્યું. ગામની ભાગોળે તળાવની પાળે હારબંધ પાળિયા. દરેકની ઉપર મરનારનું નામ અને આયુષ્યની અવધિ નોંધલી. છ-બાર માસ, વરસ-બે વરસ, ત્રણ-ચાર વર્ષથી કોઈ વધુ નહિ.

ગામ લોકો આટલા બધા ટૂંકા આયુષી ? કુટુંબે વસવાટનો નિર્ણય તત્કાળ ફેરવ્યોને ગાડાં જોડી પાછા જવા નીકળ્યા. ગામના ઘરડાઓએ આ જોયું ને પાછા વાળવા માણસ દોડાવ્યો, તે કુટુંબના મોભીને પાછો વાળી લાવ્યો.

"કાં કેમ પાછા વળ્યા ? અમારો કાંઈ વાંક ગુનો ?"

"મા'જન પાળિયા જોયા પછી મન ના માન્યું. જે ગામમાં કોઈ પાંચ વરસેય ન જીવે ત્યાં છોરૂ-વાછરૂં સોતાં વસવાટ કેમ કરીને કરવો ?"

"ભેરૂ ! તમે ના સમજ્યા. અમારૂ ગામ છે સત્સંગી. નારાયણને સંભારીએ એટલું જ જીવ્યું લેખે, બાકીનું અમે અલેખે ગણીએ છીએ. એટલે સૌ રોજ રોજના નામ કીર્તનની ઘડી નોંધે, તે મરે ત્યારે એટલું જ જીવ્યો એમ લખાય. ઈ નોંધ પાળિયા ઉપર છે. આ હૈયે બેસતું હોય તો તમ તમારે નિરાંત જીવે ગાડાં પાછાં વાળો ને આવો"

પેલાં પાછા આવ્યાં ને જાત-મહેનતે જીવી સત્સંગે ભવ તર્યા. ●●●

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1479/page/n21/mode/1up

2010-09 -Satpanth Prakash (1479)

realpatidar.com



જન્માષ્ટમી

યુગાવતાર ભગવાન કૃષ્ણ. ભારતીય સંસ્કૃતિમાં કૃષ્ણનો અવતાર પ્રેમાવતાર છે. પ્રત્યેક હિંદુના હૃદયમાં આજે પણ કૃષ્ણ બિરાજી રહ્યા છે. કૃષ્ણાવતાર એ ભારતનો પૂર્ણાવતાર છે.

ભારતની ભૂમિને આવું અભય વચન શ્રીકૃષ્ણ આપી શકે. ભારતમાં કૃષ્ણાવતાર શ્રેષ્ઠ ગણાય છે. ભગવાને ભક્તોને શરણાગતીનો અમર સંદેશ આપ્યો છે.

હે વત્સ ! તારા મનમાં પડેલા અને માનેલા સર્વે ધર્મોને ભજીને મારા જ શરણે આવ, તો હું તને સર્વ પાપો થકી મૂકાવીશ. તું શોક કરીશ નહિ.

પ્રભુનું અભય વચન છે. "તમો મારે શરણે આવો હું તમારુ સર્વ રીતે રક્ષણ કરીશ તમારા યોગક્ષેમની જવાબદારી મારી છે. આવું અભયંવચન ભક્તોને ભગવાન જ આપી શકે.

ભિષ્મ જેવા ભિષ્મ કૌરવોના પક્ષે હતા પણ મહાનુભાવોની ભરી સભામાં તેઓ બોલ્યા હતા કે : "વાસુદેવ જ આ ચરાચર વિશ્વની ઉત્પત્તિ અને પ્રલય સ્વરૂપ છે. આ ચરાચર પ્રાણી જગતનું અસ્તિત્વ તેમના થકી જ છે. ભગવાન કૃષ્ણ જ અવ્યક્ત પ્રવૃત્તિ સનાતન કર્તા અને સમસ્ત પ્રાણીઓના અધિપતિ છે તેથી તેઓ જ પરમ પૂજનીય છે. દેવર્ષિ નારાયણે આ પ્રસ્તાવનું સમર્થન કર્યું છે."

ભગવાન કૃષ્ણે ગીતામાં અર્જુનને સ્વમુખે જણાવ્યું છે કે "હું અજન્મા અવિનાશી ઈશ્વર છું સત્ પુરુષોની રક્ષા દુષ્ટોનો વિનાશ તથા ધર્મની સ્થાપના કરવા હું સમય સમય પર અવતાર ધારણ કરું છું." (૪/૬/૮ ગીતાજી)

શ્રી ભગવાને જણાવ્યું છે કે જે મારો આશ્રય કરે છે. મારા જન્મ કર્મોની દિવ્યતાને જાણી લે છે તે પણ જન્મ-મરણના ચક્કરથી છૂટી જાય છે. ભગવાનની લીલાનો ત્યાગ મેળવવો સામાન્ય માણસનું કામ નથી. અવિનાશી પરબ્રહ્મ સ્વરૂપને ઓળખવું મુશ્કેલ છે.

જ્યારે દિવ્ય સ્વરૂપે ભગવાન કૃષ્ણ વિચરી રહ્યા હતા ત્યારે પણ કંસ, જરાસંઘ, શિશુપાલ અને દુર્યોધન જેવા ઓળખવામાં ગોથુ ખાઈ ગયા હતા. આજ પૂર્ણાવતાર ભગવાનની લીલા છે ! પ્રભુનું સામર્થ્ય ઓળખવું મુશ્કેલ છે. અર્જુને ભગવાન કૃષ્ણને પોતાના રથના સારથિ બનાવ્યા પ્રભુનો જ આશ્રય કર્યા ત્યારે અર્જુન પર કૃપા કરી તેને પોતાના વિશ્વરૂપનાં દર્શન કરાવ્યાં કેવો અર્જુન પ્રેમ ? ગીતામાં અભંમ ઉપદેશ સ્વરૂપે એ જ છે કે તેઓ જગતથી અતીત કૂટસ્થ આત્માથી પણ શ્રેષ્ઠ પૂર્ણતમ પુરુષોત્તમ છે.

પરમાત્મ તત્ત્વ જાણવા આપણા 'અહમ્'ને ઓગાળી તેમનું શરણ સ્વીકારવું પડે.

કુરૂક્ષેત્રમાં અર્જુનની અને ભગવાન કૃષ્ણની સાથે અગ્રેસર લડવામાં ભિષ્મ, બાણશૈયા ઉપર પડેલા છે ત્યારે પોતાનું જીવન ધન્ય થઈ જાય માટે ઉત્તરાયણના સૂર્યની પ્રતિક્ષા કરી અંતિમ દર્શન માટે ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિક્ષા ભીષ્મ કરી રહ્યા છે. કેવી કૃષ્ણ ભક્તિ ?

ભગવાનનું નામ જ પરમ આનંદ આપનારું છે. પાંચ હજારથી વધુ વર્ષો થયાં આજે પણ "નંદ મહોત્સવ" ભક્તોને આનંદ આપે છે.

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com
Page 20 of 38

https://archive.org/details/bk1479/page/n22/mode/1up

નંદ મહોત્સવ એ જીવને આનંદ આપનાર મહોત્સવ છે. હૃદય પ્રેમથી પ્રભુના સ્મરણથી નાચી ઉઠે છે. ઝળી ઉઠે છે. લોકો મસ્ત બની નાચી - ઝૂમી ઉઠે છે. નાચતી વખતે પોતાની પદ પ્રતિષ્ઠા ભૂલીને તે મસ્ત બની જાય છે. 'નંદ મહોત્સવ' જેને માણ્યો હોય તેને જ આ ઉત્સવ અને પ્રભુના દિવ્ય અવતારનો ખ્યાલ આવે !

પ્રત્યેક વર્ષે 'જન્માષ્ટમી' આવે છે. પણ હમણાં જ પ્રભુ પ્રકટયા હોય તેવો દિવ્ય ભાવ જન્મે છે ! આ પર્વ બધાંને પ્રિય છે.

ભગવાન કૃષ્ણના અનેક સ્વરૂપો છે. અર્જુનના સખા, ગીતાના ગાયક, યોગીઓના યુગા અવતાર, વ્રજભક્તો અને ગોપીઓના પ્રાણાવતાર, ભાવુકોના પ્રભુ ! પણ પરમ તત્ત્વ બધામાં પ્રભુનું એક જ છે એટલે જ કૃષ્ણ સર્વત્ર પૂજાય છે.

ભગવાન કૃષ્ણે વ્રજમાં ખુલ્લા પગે ફરી વ્રજનો મહિમા વધાર્યો છે. વૃંદાવનમાં જવાથી ભૂલથી વ્રજ રજ મસ્તક ઉપર પડે તો જીવન ધન્ય થાય છે. આ બધું શ્રીકૃષ્ણના પ્રતાપે જ આજે વ્રજમાં વેણુ, અને રેણુંનું મહત્વ આથી મનાય છે. ભગવાન કૃષ્ણ વિના વ્રજની કલ્પના થઈ શકે નહિ. વ્રજનો કોઈ પર્યાય નથી ! વ્રજ એટલે જ કૃષ્ણ.

કૃષ્ણની બંસી આટલા વર્ષો થયા યાદ આવે છે. હજુ સુધી આવા વાંસળીના સૂર સાંભળવા મળતા નથી. કૃષ્ણની વાંસળીમાં અદ્‌ભૂત જાદુ હતો. એક જ સૂરી વ્રજની ગાયો કૃષ્ણની પાસે આવી જતી. ગોપીઓ ઘેલી બની ઘરના કામકાજ ત્યજીને આવી જતી. કેવો વાંસળીનો પ્રતાપ ?

લૌકીક જગતમાં બાબો જન્મે છે તો પેંડા વહેંચાય તો આ જન્માષ્ટમીએ જગતનો નાથ જન્મે છે તો જન્મોત્સવ કેમ ન ઉજવાય ? હવે તો બાળકો "હેપ્પી બર્થ ડે" પ્રત્યેક વર્ષે ઉજવે છે તો પ્રભુનો આ દિવ્ય અવતાર કેમ ન ઉજવાય ?

ભૌતિક યુગમાં હતાશા, નિરાશા, વ્યથાઓ ચિંતાઓથી માનવ ત્રાસી ગયો છે.ત્યારે આ જન્માષ્ટમી તેને માનસિક શાંતિ આપશે. હૃદયમાં પ્રભુ પ્રત્યેની આસ્થા જગાવશે !

માનસિક શાંતિ માટે જન્માષ્ટમી પર્વ શ્રેષ્ઠ છે. જન્માષ્ટમીએ પ્રભુને પ્રાર્થના કરવી કે જીવનમાં નંદ મહોત્સવનો સદાય આનંદ આપજો.

જન્માષ્ટમી એ ભક્તિમાં આગળ વધારનાર શ્રેષ્ઠ પર્વ છે. ●●●

પ્રશ્ન :

ઋષિઓએ સુત પુરાણીને પ્રશ્ન કર્યો છે કે : "ભગવાન કૃષ્ણ ધામમાં ગયા પછી "ધર્મ" કોને શરણે ગયો ?

જવાબ :

"ધર્મ મારા સાત્વિક સાચા "સંત"ને શરણે ગયો છે." માટે પ્રભુના સંકીર્તનથી અંતરમાં પ્રભુ પ્રકટે છે ! હૃદય અને જીવનમાં 'નંદ ઉત્સવ' ઉજવાય છે.

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1479/page/n23/mode/1up

2010-09 -Satpanth Prakash (1479)

realpatidar.com

ધ્યાન રાખજો હાથમાં (મનમાં) હથોડો કે ઘણ કોઈ સંપ્રદાયનો આવી ન જાય. નહીં તો જે દશા આપણા મહોત્સવની થઈ એ જ દશા આપણા મગજના કમ્પ્યૂટરની થશે. આ એ જ સંપ્રદાયો છે કે જેમને ઘર, કુટુંબ, સમાજ કે રાષ્ટ્રને છોડ્યા નથી. આવી હજારો સંપ્રદાયોનો રોગ સમસ્ત વિશ્વમાં જીર્ણ તાવથી લઈને ભયંકર જીવલેણ ટી.બી.ના રોગના દ્વાર સુધી પહોંચાડવાનું કામ કરી શકે છે એ સમજથી આપણે બહુ દૂર છીએ.

આ સંપ્રદાયોના સકંજામાંથી છૂટવાને બદલે એમનો આપણે સામ-સામે એક બ્રહ્માસ્ત્ર રૂપ હથિયાર માની ઉપયોગ કરી રહ્યા છીએ. કે જે કુટુંબ, સમાજ, રાજ્ય કે રાષ્ટ્રને ક્યારેય બેઠો ન કરી શકીએ. એ દયનીય સ્થિતિ પેદા કરી રહ્યા છીએ. આપણે ક્યારે સમજી શકીશું આ સંપ્રદાયોના દુષણોને.

હાલ છેલ્લા દસ-પંદર વર્ષો થયા આપણી લગભગ સમગ્ર સમાજમાંથી દરેક જુદા જુદા શાખના પરિવારોના મિલનના સમાચાર પાટીદાર સંદેશના માધ્યમ દ્વારા જાણવા મળી રહે છે. એ અભિનંદનને પાત્ર છે. જેમ કાદવમાંથી કમળ ખીલે એમ દરેક જુદી જુદી સંપ્રદાયોના જુદા જુદા વિચારોને એક બાજુ મુકી પરિવારોના મિલન પ્રસંગને ખરા હૃદયના ઉમળકાભેર ઉજવતા હોય છે જે આપણે પણ અનુભવી રહ્યા કે માણી રહ્યા છીએ. તે દાદ માગી લે તેવી સુખદ ઘટનાઓ પણ નજર સામે દેખાય છે. તેમાં આપણી સમાજના વહીવંચાએ આપણો હજારો વર્ષનો ઈતિહાસ રજુ કરી સમજાવ્યો કે આપણે ક્યાંથી આવ્યા, કયુ ગોત્ર કે કયા ઋષિના વંશજ છીએ. એ જાણી ગૌરવભેર કહીએ છીએ કે અમે આ ઋષિના વંશજ પરિવાર છીએ. ત્યાં સુધીનો વિકટ અને લાંબો રસ્તો આપણે કાપી ચુક્યા છીએ. હવે ફક્ત એ જાણવાનું બાકી રહ્યું કે આપણા પૂર્વજ ઋષિયો કયા ધર્મની વિચારધારાના હતા. કારણ કે સંપ્રદાયોને બહુ ઝાઝાં વરસો થયાં નથી. કોઈને બસો, ચારસો કે આઠસો થયા છે. બુધ્ધ કે જૈન સંપ્રદાયને પચીસો આસપાસ થયાં છે. આ પ્રસંદાયોને મિટાવવા લગભગ બારસો વર્ષ આસપાસ આપણા આદ્યશંકરાચાર્ય થયા તેમને ખૂબ જ જહેમત ઉઠાવી. વેદોના સિધ્ધાંતો લોકોને સમજાવી સમગ્ર ભારતમાં છવાયેલ બૌધ્ધ સંપ્રદાયને ભારતમાંથી હાંકી કાઢ્યો. હાલ પણ આપણને જરૂર છે એવા વેદોના વિચારો સુધી પહોંચવાની એમના સિવાય એકપણ માર્ગ દેખાતો નથી. પરમકૃપાળુ પરમાત્મા સૌને સદ્બુધ્ધિ આપે એજ આશા સાથે અસ્તુ. ●

॥ ૐ શ્રી નિષ્કલંકી નારાયણાય નમઃ ॥

ભરત ડી. પોકાર : મો. ૯૪૨૭૬ ૨૬૧૨૪   જયેશ ડી. પોકાર : મો. ૯૪૦૮૫ ૦૧૭૯૧

શ્રી નિષ્કલંકી ફૂલ ભંડાર એન્ડ આઈસ્ક્રીમ પાર્લર

અમારે ત્યાંથી ફૂલની ચાદર, કાપડની ચાદર, શ્રીફળ, પ્રસાદ, ચંદન, અગરબત્તી, લોબાન વગેરે વ્યાજબી ભાવે મળશે.

તેમજ



ગાડી ભાડે મળશે

સદ્ગુરુ શ્રી ઈમામશાહ મહારાજ સમાધિ મંદિરના મુખ્ય દરવાજા પાસે,
બસ સ્ટેશનની બાજુમાં પીરાણા, તા. દસક્રોઈ, જી. અમદાવાદ.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1479/page/n24/mode/1up

ફરી વાંચવો પાના નંબર 45

સમગ્ર સમાજનો લાગણીસભરનો એક આર્તનાદ

- ડાહ્યાભાઈ પ્રેમજીભાઈ માકાણી, નવાનગર.

શ્રી અખીલ ભારતીય કચ્છ કડવા પાટીદારની સમગ્ર સમાજે ઉજવેલ સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગ અખીલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજની સ્થાપનાને પચાસ વર્ષ થયાં એ નિમિત્તે ઉમળકાભેર ઉજવાતો આ પ્રસંગ સમાજ માટે ખૂબ આનંદનો પ્રસંગ ગણાય. આવા પ્રસંગો દરેક વ્યક્તિના જીવનમાં એક કે બે વખત ભાગ્યે જ આવતા હોય છે અને એ આખા જીવનભર યાદગાર બની રહે છે કે જે પાછળની પેઢીને એમની યાદો ઉમળકાભેર તાજી કરી સમજાવતાં હૈયુ હૃદય અને છાતી ગજ ગજ ફુલે એવો આનંદ આવે.

સમાજની એકતાથી ભરપુર આનંદભર્યા પ્રસંગની વાતો પાછળની પેઢીના બાળકો અને યુવાનોના હૃદયમાં સમસ્ત સમાજના ગૌરવનાં બીજ રોપાય અને એક અખંડીત સમાજની ભરપુર લાગણીઓ ફાલી ફુલી રહે એ જોવાનું અને ઉત્સાહ વધારવાનું કામ વર્તમાન સમયની પેઢી અને કાર્યકર્તાઓના શીરે જવાબદારી હોય છે. એમની સફળતા કે નિષ્ફળતા, જશ-અપજશ સમગ્ર સમાજને ફાળે જાય છે. આવું જ આપણા સુવર્ણ જયંતિ મહોત્સવના પ્રસંગમાં જાણવા મળ્યું. એ સમગ્ર સમાજ માટે ખુબ દુઃખદ ગણાય. જેને કહીએ કે સુવર્ણની થાળીમાં લોઢાની મેખની કહેવતના ઉદાહરણ રૂપ કચ્છ કડવા પાટીદારની છાપને કલંકરૂપ ગણાય એવું નથી લાગતું ? કેમ કે આજથી આગળની પંદર વીસ પેઢીઓ કે સો - બસો વર્ષના ઈતિહાસ રૂપ વાતો સાંભળતા આવ્યા છીએ કે પચ્ચીસ - પચાસ વર્ષથી જોતા આવ્યા છીએ કે આપણી સમાજમાં રીતરીવાજોના પ્રસંગો વખતે કૌટુંબિક વાંધા - વચકા કે મતભેદો હોય તો કૌટુંબિક વડીલો કે આગેવાનો કહેતા જ હોય છે કે એક વખત પ્રસંગ ઉજવી લો. બાકી વાત કે પ્રશ્નની ગૂંચ પછી ઉકેલી લઈશું અને એ પ્રસંગ સુખરૂપ ઉજવાઈ જતા. અને પ્રશ્નોના ઉકેલ પણ થઈ જતા. એ હતી આપણા સમાજની સમજદારી.

બહુ ઓછી કોર્ટ કચેરીની જરૂર રહેતી જેની નોંધ બીજા સમાજના લોકો લેતા. આજે એ સમજદારી કે સમજણને અભેરાઈએ ચડાવી અને એક આખા સમાજની ઐતિહાસિક સુવર્ણ જયંતિના મહાન ઉજ્જવળ પ્રસંગને કલંક લગાડવાનું કામ આપણે કર્યું. ક્યાં ગઈ એ સમજદારી ? કોઈ પણ વાંધો વિરોધ સામાજિક રીતનો કે હિસાબી કે કોઈ અન્ય ગમે તેવો પ્રશ્ન હોય એ જનરલ સાધારણ સભા, કારોબારી કે કોઈ પણ અખીલ ભારતીય વાંધા વિભાગની સમિતિ દ્વારા ઉકેલ કરી શકાય છે. નહીં કે આવા સુવર્ણ મહોત્સવના પ્રસંગ વખતે. શું મેળવ્યું બંને પક્ષકારોએ ? શું આપવા માગીએ છીએ પાછળની પેઢીને ? સમાજના બે ભાગ પાડવા સુધીની વિચારધારા સુધી પહોંચ્યા. શું ભાગ પાડીને સિધ્ધિ મેળવી શકાશે કે આનંદ અપાવી શકાશે ? વિચાર્યું છે કે પરિણામ શું આવશે ?

કોઈ શાંત જગ્યાએ એકાંતમાં બેસી સમગ્ર સમાજની લાગણી એકતા, વહેવારો, સગપણના સંબંધો જેવી અનેક બાબતોને ધ્યાનમાં લઈ પોતપોતાના અંતર આત્માને ખરા હૃદયના ભાવથી ઢંઢોળી પુછી જોજો, તે તેના નફા - નુકશાન, સારા-નરસાનો હિસાબ દરેકના મગજના કમ્પ્યૂટરો બતાવી આપશે, એવી પરમકૃપાળુ પરમાત્માએ વ્યવસ્થા કરેલી જ છે. જરા વિચારોને સાત્વિક બુધ્ધિના એરણ ઉપર મુકી અનુભવ કરી જોજો. પણ

realpatidar.com

https://archive.org/details/bk1479/page/n25/mode/1up

2010-09 -Satpanth Prakash (1479)

realpatidar.com

વિજ્ઞપ્તિ

નવેમ્બર - ૨૦૧૦ દીપોત્સવી અંક તેમજ દ્વિવિધ મહોત્સવ અંક અંગે

'સતપંથ પ્રકાશ' નવેમ્બર - ૨૦૧૦નો માસિક અંક 'દીપોત્સવી અંક' તેમજ 'દ્વિવિધ મહોત્સવ અંક' તરીકે સંયુક્ત પ્રગટ થશે. તો સૌ વાચક મિત્રો તેમજ સતપંથી ભાવિક હરિભક્તોએ પોતાની દિવાળી શુભેચ્છાઓ તેમજ બિઝનેશ, ધંધા અંગેની જાહેરાતો આપવાની હોય તો છેલ્લી તા. ૨૦-૧૦-૨૦૧૦ સુધીમાં સત્વરે 'સતપંથ પ્રકાશન સમિતિ'- પ્રેરણાપીઠ પીરાણાને મોકલી આપશો અથવા આપના નજીકના એરીયા પ્રમાણે જણાવેલ પ્રતિનિધિને રૂબરૂ તા. ૧૫-૧૦-૨૦૧૦ સુધીમાં મોકલી આપશો. એરીયા પ્રતિનિધિની યાદી પેજ નં. ૨૦ ઉપર છે.

દીપોત્સવી અંક માટે જાહેરાતના દર

ટાઈટલ પેજ : ૨,૩,૪	૧૫૦૦/-	અંદરના પાને સાદુ અડધું પેજ	૬૦૦/-
અંદરના પાને રંગીન આખું પેજ	૧૫૦૦/-	અંદરના પાને સાદુ ૧/૪ પેજ	૩૫૦/-
અંદરના પાને રંગીન અડધું પેજ	૮૫૦/-	અંદરના પાને સાદા પેજ પર ટ.જા. - હાર્દિક શુભેચ્છા (૭ X ૪ સેમી.)	૧૫૦/-
અંદરના પાને સાદુ આખું પેજ	૧૦૦૦/-		

નોંધ : ટાઈટલ પેજ ૨, ૩, ૪ ની જાહેરાતો વહેલા તે પહેલાના ધોરણે નોંધવામાં આવશે.

જાહેરાત મોકલવાનું સરનામું :

સંપાદક શ્રી,
સતપંથ પ્રકાશન સમિતિ
પ્રેરણાપીઠ પીરાણા, તા. દસક્રોઈ, જિ. અમદાવાદ - ૩૮૨ ૪૨૫.
ફોન : (૦૨૭૧૮) ૨૮૮૮૧૨ ફેક્સ : ૦૨૭૧૮-૨૮૮૮૭૨ મો. ૯૪૨૮૧ ૩૪૮૧૫

લેખકોને નમ્ર નિવેદન

માનવંતા લેખક મિત્રોના ધ્યાન પર એ વાત લાવવા માગીએ છીએ કે "સતપંથ પ્રકાશ"નો નવેમ્બર - ૨૦૧૦નો અંક "દીપોત્સવી અંક" તેમજ "દ્વિવિધ મહોત્સવ અંક" તરીકે સંયુક્ત પ્રગટ થશે. તો સૌ લેખક મિત્રો તેમજ ભાવિક હરિભક્તોને નમ્ર નિવેદન છે કે આપ ઉપરોક્ત અંકને અનુરૂપ આપના લેખો મોકલવા માગતા હો તો તા. ૨૦-૧૦-૨૦૧૦ સુધીમાં આપના લેખો સતપંથ પ્રકાશન કાર્યાલયને મળી જાય તે રીતે મોકલવા કૃપા કરશો. જેથી આપના લેખોને યોગ્ય ન્યાય મળી રહે.

આપના લેખો ધાર્મિક, નીતિ પરાયણ અને સંસ્કાર-સંસ્કૃતિના પથદર્શક હોવા જરૂરી છે. આપના લેખો વધુમાં વધુ બે પેજમાં સમાવેશ થાય તેવા સ્વચ્છ અક્ષરે મોકલવા નમ્ર વિનંતી. લેખ અંગેની સંપૂર્ણ જવાબદારી લેખકની રહેશે.

●●●

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com
Page 24 of 38

https://archive.org/details/bk1479/page/n26/mode/1up

2010-09 -Satpanth Prakash (1479)

realpatidar.com

સતપંથ પ્રકાશનું લવાજમ ભરવા અંગે...!!!

ભારતભરના જુદા જુદા વિસ્તારમાં આપણા સતપંથી સ્વજનો સુધી 'સતપંથ પ્રકાશ'ના લવાજમ તેમજ જાહેરાત સ્વીકારવા એરીયા પ્રમાણે નીચે જણાવેલ સેવાભાવી પ્રતિનિધિઓની નિમણૂંક કરેલ છે. તો સેવાભાવી પ્રતિનિધિ આપની મુલાકાતે આવે ત્યારે વધુને વધુ ગ્રાહકો બનાવવા સહકાર આપવા વિનંતી.

- **શ્રી પુંજાભાઈ સવગણભાઈ રામજીયાણી**
  મે. ગુરૂકૃપા હાર્ડવેર સ્ટોર્સ, મુ.પો. દેશલપર વાંઢાય, તા. ભુજ, જિ. કચ્છ - ૩૭૦૦૪૦.
- **શ્રી શાંતિલાલ કે. પટેલ**
  મે. રોયલ વિડીયો, પંચમુખા હનુમાન શેરી, ભુજ, જિ. કચ્છ - ૩૭૦૦૦૧.
- **શ્રી જેઠાલાલ કાનજીભાઈ સેંઘાણી**
  મે. ઉમીયા ટ્રેડીંગ કંપની, એસ.ટી.રોડ, માંડવી, જિ. કચ્છ - ૩૭૦૪૬૫.
- **શ્રી અમૃતલાલ જીવરાજભાઈ રૂડાણી**
  મુ.પો. નાના આંગીયા, તા. નખત્રાણા, જિ. કચ્છ - ૩૭૦ ૬૭૫
- **શ્રી દિલીપભાઈ રામજીભાઈ ધોળુ**
  મે. જ્યોતિ ઈલે. એન્ડ જનરલ સ્ટોર્સ, કોટડા (ચ.) તા. ભુજ-કચ્છ- ૩૭૦૧૦૫.
- **શ્રી શામજીભાઈ અરજણભાઈ પટેલ**
  મુ.પો. ગાડુકંપા, તા. ખેડબ્રહ્મા, જિ. સાબરકાંઠા.
- **કેશુભાઈ એમ. પટેલ**
  દુધાથલલાટ, કપડવંજ
- **ભાવનાબેન બાબુભાઈ રાણા**
  છત્રેશ્વરીપોળ, ખંભાત. મો. ૯૭૨૬૦૮૪૭૫૭
- **જશુભાઈ કે. પટેલ**
  વિઠ્ઠલપુરાલાટ, કપડવંજ
- **મોહનભાઈ સોમદાસ રામજીયાણી**
  મુ.પો. વડાગામ, તા. ધનસુરા, જિ. સાબરકાંઠા. C/o. લીડર કાપડ સ્ટોર્સ
- **શ્રી પંકજ કે. ભીમાણી**
  વિજય ટોકીઝની બાજુમાં, રેલ્વે સ્ટેશન, ખેડબ્રહ્મા, સાબરકાંઠા.
- **શ્રી જયેશકુમાર જે. પટેલ**
  ૩૩/૧, અંબિકા નિકેતન મંદિર પાસે, અઠવા લાઈન્સ, સુરત.
- **શ્રી કસ્તુરભાઈ એલ. પટેલ**
  ૩૪, શાંતિકુંજ સોસા.નં.૨, માંજલપુર વડોદરા-૩૯૦૦૧૧
- **શ્રીકેષભાઈ ડી. પટેલ**
  કે.પી. સ્ટ્રીટ, ભીમપોર, જિ. સુરત - ૩૯૪૫૧૦.
- **શ્રી પ્રવિણચંદ્ર નગીનદાસ રાણા**
  ૪/૩૭૪૬, હાથી ફળીયા, બેગમપુરા,સુરત-૩૯૫૦૦૩.
- **શ્રી હર્ષદકુમાર રામજીભાઈ પટેલ**
  મુ. મેધકંપા, તા. વડાલી, જિ. સા.કાં. ૩૮૩૨૩૫.
- **શ્રી ભરતકુમાર વી. પટેલ**
  મે. અંબિકા ટ્રેડીંગ કંપની, ખડસુપા બોડીંગ, નવસારી, જિ. વલસાડ - ૩૯૬૪૪૫
- **શ્રી મગનભાઈ અરજણભાઈ પટેલ**
  શ્રી શિવશક્તિ સો મીલ, સુથાર ફળીયા, માંડવી, જિ. સુરત - ૩૯૪૧૬૦.
- **શ્રી મધુભાઈ અંબારામ અંધારીયા**
  સુભાષનગર, ન્યુ એરોડ્રામ રોડ, ક્ર્ષ્ણા ટાઉનશીપ, બ્લોકનં. ૧૦૪, ભાવનગર.
- **શ્રી દેવશીભાઈ વી. જબુવાણી**
  મે. શ્રી રામ ટીમ્બર માર્કેટ, ઉન્કલ-હુબલી, કર્ણાટક-૫૮૦૦૩૧ ફોન : ૦૮૩૬-૩૭૨૨૩૮
- **શ્રી કરમશીભાઈ પરબતભાઈ ભાદાણી**
  મે. ગણેશ ટીમ્બર ડીપો, ત્રીચી રોડ, નામકલ, તામિલનાડુ - ૬૩૭૦૦૨
- **શ્રી શામજીભાઈ લધ્ધાભાઈ ધોળુ**
  ૧૦, સંકેત સોસાયટી, પાર્થો ગાંગુલી, ન્યુ સમા રોડ, અભિલાષા ચાર રસ્તા, નિઝામપુરા, વડોદરા.
- **શ્રી રમેશભાઈ નાગજીભાઈ રામાણી**
  શીવમ વુડ વર્કસ, ૩/૧૩૨, તાંજાવુર મેઈન રોડ, યુ.ડી.સી. કાટુર, ત્રિચિનાપલ્લી. મો.૯૪૪૩૧૫૪૯૪૦
- **શ્રી કરશનભાઈ નારાયણભાઈ રંગાણી**
  શ્રી અંબિકા વુડ ઈન્ડસ્ટ્રીઝ, ૧૨૫, જી.એસ.ટી. રોડ, ક્રોમ્પેટ, ચેન્નાઈ. મો. ૦૯૩૮૪૫૨૫૨૫૨
- **શ્રી ગંગદાસભાઈ દેવજીભાઈ છાભૈયા**
  શ્રી ભવાની સૉ મીલ એન્ડ ટ્રેડર્સ, ૨૪૦, ઉડમલેઈ રોડ, પોલાચા. મો. ૦૯૪૪૩૩૭૭૮૪૯

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1479/page/n27/mode/1up

realpatidar.com

આરોગ્ય અને ઔષધ

ઢીંચણનો દુ:ખાવો

- ડૉ. અરૂણકુમાર સી. પોકાર, અમદાવાદ.

સવાર પડતાંની સાથે જ મને સખત ઢીંચણમાં દુ:ખે છે. પગ હલાવાતો નથી. જમીન ઉપર માંડતાં પગમાં સખત સણકા મારે, ચાલવા જતાં આંખમાંથી પાણી નીકળી જતું. એવી ફરીયાદ વૃધ્ધ અને યુવાન દરેકમાં સાંભળવા મળે છે. ઢીંચણને સીધો કરતાં કે વાળતાં વચ્ચે હાડકામાંથી કટક કટાક અવાજ આવે. વધુ સમય ઊભા ના રહી શકાય. બેસીને ઊભા થતાં કે ઊભા હોઈએ અને ચાલવાનું ચાલું કરતાં ઢીંચણના સાંધામાં સખત સણકા મારતા. ક્યારેક બળતરા પણ બળતી. પગ સૂજીને ફૂલી જતા. સાંધા લાલ થઈ જતા અને લબકારા મારતા. આરામ કરવાથી થોડો સમય સારૂ રહેતું અને ફરી પાછો દુ:ખાવો ચાલું. વરસાદની ઋતુ ચાલુ થતી અને હવામાં ઠંડક - ભેજ વધતા ઢીંચણના દુ:ખાવાની તકલીફ ખૂબ જ વધી જતી. સંડાસ - બાથરૂમ કરવામાં અસહ્ય પીડા થતી. સ્નાન કરવા કે જમવા પણ ટેબલ કે ખુરશીમાં જ બેસવું પડતું.

સાંધાનો ફોટો પડાવીએ તો કોઈ કહે હાડકાનો ઘસારો, કોઈ સાંધા વચ્ચે જગ્યા થઈ ગઈ કહે, વળી કોઈ ઢાંકણીનું કારણ બતાવે. કમરના મણકાથી નસ દબાતી હશે તેવું કોઈ કહે, સાંધામાં પાણી ભરાઈ ગયું ને સોજો આવ્યો છે તેવું તારણ નીકળે. જુદા જુદા તબીબના જુદા જુદા નિદાન. પછીથી અનેક દવા, ગોળી, ઈન્જેક્શનોનો પ્રયોગ દર્દી પર થાય, પરંતુ થોડાક દિવસના ફાયદા બાદ પરિસ્થિતિ હતી તેની તે જ.

ઢીંચણમાં દુ:ખાવો થવાના કારણો જાણીએ તો ઢીંચણનો સાંધો જે વ્યક્તિઓને વધુ પડતા વપરાશથી ઘસાઈ ગયો હોય તેને દુ:ખાવો વહેલો ચાલુ થાય છે. જે વ્યક્તિઓના વજન વધારે હોય તેમને ઢીંચણ ઉપર વધુ પડતું વજનનો ભાર રહેવાથી બે હાડકાં ઘસાય છે અને કટ-કટ અવાજ સાથે દુ:ખાવો રહે છે. તેમને બેસતાં, ઊઠતાં ઉપરાંત ચાલવામાં પણ સતત દુ:ખાવો ચાલુ જ રહે છે તથા દુ:ખાવો ઋતુ પ્રમાણે વધ-ઘટ થાય, પણ બારે માસ રહે છે. આવા દર્દીઓએ વજન ઘટાડવું જરૂરી બને છે. શરીરમાં કેલ્શિયમની ઊણપ વર્તાય તો શરીરના બધાં હાડકાને, સાંધાને વધતી ઓછી અસર પહોંચે છે. દર્દી કેલ્શિમય પૂરતો લે નહીં અથવા તો શરીરમાં કેલ્શિયમનો સંગ્રહ થવાને બદલે તેનો નિકાલ થવા લાગે, માંદગી વખતે દર્દીએ જરૂરી બહારથી કેલ્શિમયની ગોળીઓ લીધી ના હોય કે ગર્ભાવસ્થા દરમ્યાન સ્ત્રીઓ કાળજી ના લે અથવા તો નાનપણથી બાળકને કેલ્શિયમવાળો ખોરાક આપવામાં આવ્યો ના હોય તો સાંધાની તકલીફ થઈ શકે છે. સાંધાને પોષણ પાડતી વાહીનીઓમાં તકલીફ ઊભી થાય કે સંવેદના પસાર કરતી નળીઓ પર દબાણ આવે, સાંધાની ગાદી ઘસાય, સાંધા વચ્ચેના પાણીમાં ફેરફાર થાય કે લોહીમાં વા નું પ્રમાણ વધે એટલે કે ગાઉટ થાય તો પણ ઢીંચણમાં દુ:ખાવો થઈ શકે છે.

હોમિથયોપેથીક ચિકિત્સામાં ઢીંચણના સાંધાના દુ:ખાવા માટે અકસીર અનેક દવાઓ છે. પરંતુ વરસાદમાં દુ:ખાવો વધે કે ચાલતા દુ:ખાવા થાય કે રાત્રે દુ:ખાવો વધે અથવા સવારે વધારે થાય તો અલગ-અલગ દવાઓ અપાય છે જેમાં રૂટા, બ્રાયોનીયા, મેગફોસ, સલ્ફર, બેલાડોના, રોડોડેન્ડ્રોન, વગેરે અનેક દવાઓ નિષ્ણાંત હોમિયોપેથીક કન્સલટન્ટના માર્ગદર્શન પ્રમાણે લઈ શકાય છે.

●●●

realpatidar.com

https://archive.org/details/bk1479/page/n28/mode/1up

realpatidar.com

સત્સંગ ભક્તિ જ્ઞાનયજ્ઞ સમારોહ

પ્રેરણાપીઠ - પીરાણા, (તા. ૨૬-૭-૨૦૧૦ થી તા. ૫-૮-૨૦૧૦ સુધી)

- બાબુભાઈ એસ. પટેલ, મેઘકંપો.

પાણીના પ્રવાહની જેમ આપણું જીવન અવિરત ગતિએ વહી રહ્યું છે. જીવન એટલે પરમાત્માની પ્રસાદી. દરેક જીવાત્માને અલગ અલગ પ્રકારે જીવવાની રીત હોય છે. તેમાં સર્વશ્રેષ્ઠ પ્રકારનું જીવન એટલે 'માનવજીવન' માનવીએ પોતાનું જીવન કેવું બનાવવું એ પોતાના હાથની વાત છે. આપણા જીવનને ક્યાં લઈ જવું એ આપણી રીત છે. પરમાત્માએ જીવન આપ્યું છે એ જીવવાની રીત આપણે શોધવાની હોય છે.

માનવ જીવન સિવાયના અન્ય જીવો કુદરતી નિયમોનુસાર જીવે છે. હિંસક જીવો હિંસા છોડતા નથી. નિર્દોષ અને ભોળા પશુઓ હિંસા કરતાં નથી. માત્ર માનવી જ એવા પ્રકારનો જીવ છે કે જેનામાં સર્વ જીવોના ગુણ સમાયેલા છે. માનવી નરમાંથી નારાયણ બને છે. માનવ મટી દાનવ બને છે. આમ તમામ પ્રકારે માનવી પોતાનું જીવન જીવી શકે છે. માનવી માટે જીવન એક વન સમાન છે. આ વનમાંથી પસાર થનાર માનવી મહાન બને છે. વિશ્વ વિભૂતી બને છે. મહાન પુરુષો સંતો - મહંતો કે ધર્મ ધુરંધરો જીવનવનમાંથી પસાર થયા છે ત્યારે મહાન અને પૂજવા લાયક બન્યા છે. જીવન માણવા જેવું છે.

યુગયુગાંતરથી માનવનું મન દુનિયાદારીની સંગતમાં રહેતું આવ્યું છે. અને તેના પ્રભાવમાં આવીને તેનું ખરૂ સ્વરૂપ ગુમાવી બેઠું છે. પણ જો તે આત્મજ્ઞાની પૂર્ણ સંતોના સત્સંગની સોબત કરે તો ધીરે ધીરે તેના પરથી દુનિયાદારી (માયા)નો રંગ ઉતરવા લાગશે અને સાચી આધ્યાત્મિકતા તથા આત્મજ્ઞાનનો રંગ ચડવા લાગશે. સંતોના સત્સંગમાં આવીને મોટા મોટા દુરાચારી તથા પાપી લોકો પોતાના દુર્ગુણો છોડી સાચા મહાત્મા બની ગયા છે. સંતોનો સત્સંગ સૌને શીતળતા આપે છે.

સંસારરૂપી મહાસાગરમાં ડૂબતા જીવો માટે સત્સંગ એ આધાર છે અને તેના સહારે માનવી ભવસાગર તરી જાય છે. સત્સંગનું અમૃતપાન કરતાં કરતાં મનનો મેલ ધોવાઈને સાત્વિક ગુણ પ્રગટ થતા જશે અને મન - ઈન્દ્રિયોને કાબુમાં રાખવાની શક્તિ આવતી જશે, આધ્યાત્મિક ઉન્નતિ તરફ આગળ વધાશે. સત્સંગ એ પારસ છે. જેના શ્રવણ માત્રથી અધમમાં અધમ પાપી પણ નિર્મળ તથા જાગ્રત બની સોના જેવો શુધ્ધ બની જાય છે.

તો આવો જ ભવ સાગરને તરવાની નાવ સમાનરૂપ એક સત્સંગ ભક્તિ જ્ઞાનયજ્ઞ સમારોહ શ્રી નિષ્કલંકી નારાયણ મહાપ્રભુજી તથા સદ્‌ગુરુશ્રી ઈમામશાહ મહારાજની કૃપા અને પ.પૂ. જગદ્‌ગુરુશ્રી નાનકદાસજી મહારાજના શુભ આશીર્વાદથી આપણા પ્રેરણાપીઠ પીરાણાના પવિત્ર ધામમાં પ.પૂ. યોગતપોનિષ્ઠ શ્રી પ્રેમદાસબાપુના સ્વમુખે દિવ્યવાણી દ્વારા સંવત ૨૦૬૬ના અષાઢ સુદ - દ્વિતીય પુનમ, તા. ૨૬-૭-૨૦૧૦થી અષાઢ વદ દસમ તા. ૫-૮-૨૦૧૦ સુધીના દિવસોમાં પરંપરાગત રીતે ભક્તિમય વાતાવરણમાં યોજાઈ ગયો. જેમાં ૫૦૦ જેટલા નિયમવ્રતધારી હરિભક્તોએ ભાગ લીધો હતો.

આ શુભ પ્રસંગની શરૂઆત તા. ૨૬-૭-૨૦૧૦ને સોમવારના રોજ સવારે ૮-૦૦ કલાકે પ.પૂ. જગદ્‌ગુરુ શ્રી નાનકદાસજી મહારાજના વરદ્ હસ્તે મંગલદીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી.

realpatidar.com

https://archive.org/details/bk1479/page/n29/mode/1up

realpatidar.com

વ્યાસપીઠ પદ પ.પૂ. જગદ્‌ગુરુશ્રીના આશીર્વાદથી પ.પૂ. યોગતપોનિષ્ઠ શ્રી પ્રેમદાસબાપુએ શોભાવ્યું હતું તથા તેમને પૂ. પંડીત શ્રી છગનબાપાએ સહયોગ આપ્યો હતો.

આ પ્રસંગે પ.પૂ. જગદ્‌ગુરુશ્રી નાનકદાસજી મહારાજે તેમની દિવ્ય વાણીમાં આશીર્વચન પાઠવતાં કહ્યું કે : આપણામાં જે અધુરાશ અને ઉણપ છે તે પૂર્ણ કરવા અહીં આવ્યા છીએ. પ્રેરણા મેળવવા આવ્યા છીએ.

"કથા સુણી સુણી ફુટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન." આવું ન થાય તેનું ધ્યાન રાખજો. આપણો સમય બગડે નહીં. કંઈક અનુગ્રહણ કરજો. સત્સંગથી આપણા આત્માનું કલ્યાણ થાય છે. આત્મા માટે શું કર્યું તેનું ચિંતન કરજો. અહીંની સુખ સાહ્યબી અહીં જ રહી જશે. નાયાકાકાનો આત્મા સૂતો હતો પણ એક સમયે એક પળ આવી. સદ્‌ગુરુ શ્રી ઈમામશાહ મહારાજે નાયાકાકા મહારાજના આત્માને જાગૃત કર્યો. લૂંટારામાંથી મહાન સંત બની ગયા. સંત તુલસીદાસનો આત્મા સૂતો હતો તેમનાં ધર્મપત્ની રત્નાવલીએ તુલસીદાસના આત્માને જગાડી દીધો. એક જ ટકોર કે 'મારા હાડ ચામડામાં મોહિત થાવ છો તેના કરતાં ભગવાન સાથે મોહિત થાવ તો તમારા આત્માનું કલ્યાણ થઈ જશે.' બસ આ એક ટકોરથી સંત તુલસીદાસનો આત્મા જાગ્રત થઈ ગયો અને કામી પુરુષમાંથી સંત બની ગયા.

સંસાર સ્વપ્નવત્ છે. આ સંસારમાં આવ્યા પછીએ તો જીવનનું કલ્યાણ કરી લેવું. ક્યારે ઓચિંતુ અહીંથી જવું પડશે કોઈ જ ખબર નથી. જેવાં કર્મો કરશું તેવા ફળ આપણને જ ભોગવવાં પડશે. કોઈ તેમાં ભાગીદાર નહીં થાય....સદ્‌ગુરુ શ્રી ઈમામશાહ મહારાજે કહ્યું છે કે

"દિન પર્તે કરો ધામસુ ધંધા,
સાંજ પડે થાવ સાહેબકા બંદા."

જીવનના નિભાવ માટે કર્મ તો કરવાં પડશે. દિવસે નીતિથી ભગવાનને સાથે રાખી સત્ય કર્મ કરો અને રાત્રે ભગવાનની ભક્તિ કરો. દિવસે કર્મ કરતાં કરતાં જાણ્યે અજાણ્યે કોઈ અધમ કાર્ય મનથી, વાણીથી કે તનથી નથી થયુંને તેનું ચિંતન કરી પરમાત્માને પ્રાર્થના કરો. સાચા ભાવથી કરેલી પ્રાર્થના ભગવાન અવશ્ય સાંભળે છે અને પાપમાંથી મુક્તિ અપાવે છે.

"હાલતાં ને ચાલતાં લેજો શ્રીહરિનું નામ,
જમ્યા પછી જીભલડીને શું છે બીજુ કામ."

હાલતાં ચાલતાં પરમાત્માનું નામ સ્મરણ કરજો. કલિયુગમાં નામસ્મરણ શ્રેષ્ઠ છે. દિવસના ગમે તે કામ કરો પણ પરમાત્માનું નામ સ્મરણ ચાલુ જ રાખજો. તો તે કામમાં પણ ભગવાન સાથે જ રહેશે અને કાર્ય સાત્વિક બનશે.

પ.પૂ. યોગતપોનિષ્ઠ શ્રી પ્રેમદાસબાપુએ જ્ઞાનયજ્ઞનું રસપાન કરવાતાં તેમની દિવ્યવાણીમાં યોગ વિશે સમજ આપી હતી. ચારે આશ્રમો વિશેનું જ્ઞાન પિરસ્યું હતું. ચારે આશ્રમોમાં ગૃહસ્થાશ્રમની સમજણ આપી સમજાવ્યું કે ગૃહસ્થાશ્રમમાં કોની કેવી ફરજો હોય છે. ગૃહસ્થાશ્રમમાં યોગને સિધ્ધ કરી ગુરુ અને સદ્‌ગુરુના આશીર્વાદથી આપણા આત્માનું કલ્યાણ થાય છે તે સમજાવ્યું હતું.

અમૃતવાણી અને મનચિત્તવરણીનું જ્ઞાન આપતાં સમજાવ્યું કે મન અને ચિત્ત કઈ રીતે બનેલાં છે. નામ સ્મરણ કઈ રીતે કરી શકાય, ચાર વાણી, પરા, પશ્યંતિ, મધ્યમા, અને વૈખરી આ વાણીની આધ્યાત્મિકતાની રીતે આપણા જીવનમાં કેવી અસર થાય છે તે સમજાવ્યું હતું. ધર્મ એટલે શું ? ધર્મ વિશે પોતાની શું ફરજ છે તેની સમજ આપી હતી.

સોળ સંસ્કારોમાં આપણા જે સારા સંસ્કારો છે તેને ભૂલીને પશ્ચિમના જગતનું આંધળું અનુકરણ કરીને આપણે વિમુખ થતા જઈએ છીએ

realpatidar.com

https://archive.org/details/bk1479/page/n30/mode/1up

realpatidar.com

તેનું તેનું જ્ઞાન આપ્યું હતું. નવધા ભક્તિમાં નિઃસ્વાર્થ સેવા અને નામ સ્મરણ ઉત્તમ ભક્તિ છે. જીવન કર્મને આધીન છે. જેવા કર્મ તેવાં ફળ આપણને મળશે તે વિશે સમજ આપી હતી. સદ્‌ગુરુ શ્રી ઈમામશાહ મહારાજે આપણને જે આહાર વ્યવહાર, આચરણ, ભક્તિ કરવાનું જ્ઞાન તેમની શિક્ષાપત્રીમાં આપ્યું છે તેની વિસ્તૃત છણાવટ કરી સમજ આપી હતી.

ભગવાનને મેળવવા માટે પાત્ર થવું પડે છે ત્યારે જ ભગવાન મળે છે. આપણામાં પાત્રતા હોય તો ભગવાનને દર્શન આપે જ છૂટકો છે. જેમ પાત્રમાં કાણું હોય તો તે કામ આવતું નથી તેમ આપણા જીવનમાં વિકારરૂપી કાણું હશે ત્યાં સુધી ભગવાન મળશે નહિ.

<u>પૂ. પંડિત શ્રી છગનભાઈ</u>એ તેમની વાણીમાં બુધ્ધ અવતાર વિશે હરિભક્તોને જ્ઞાન પીરસ્યુ હતું. કલિયુગમાં મનુષ્ય અને પ્રાણીઓમાં કોની કેવી પાત્રતા છે, તેમજ ઉત્તમ અને અધમ મનુષ્યની તુલના વિશે સમજ આપી હતી. ઉત્તમ મનુષ્ય બનવા કેવું જીવન જીવવું, કલિયુગમાં ભક્તિ કેવી રીતે કરવી. તે વિશે સમજ આપી હતી.

અંતમાં સત્સંગ પૂર્ણાહુતિ પ્રસંગે <u>પ.પૂ. જગદ્‌ગુરુશ્રી નાનકદાસજી મહારાજે</u> આશીર્વાદ આપતાં કહ્યું કે : જેમનાં પૂર્વ ભવના ભાગ્ય હોય તેને આ પવિત્ર ભૂમિમાં સત્સંગનો લાભ મળે. તમોએ અગિયાર દિવસ સત્સંગનો લાભ લીધો તેને જીવનમાં ઉતારજો. પશુ ચારો ખાઈને વાગોળે છે તેથી તેનું પાચન થાય છે તેમ તમો પણ અહિંથી જે જ્ઞાનનો આહાર વાગોળશો તો જીવન ધન્ય બની જશે.

સત્સંગ આત્માને જગાડવાનું કામ કરે છે. આપણા આત્માના કલ્યાણ માટે કેટલા શ્વાસ લીધા તેનું સરવૈયું કાઢજો. મનુષ્ય અવતાર વારંવાર નહિ મળે. દરરોજનો એક દિવસ પૂરો થાય છે તે પાછો આવતો નથી. ગઈ પળ પાછી આવતી નથી. કર્મ એવાં કરીએ કે મનુષ્યમાંથી દેવ બનીએ. માયામાં જ જીંદગી ગઈ તો જમનો માર ખાવો પડશે. ભવસાગરની ભૂલવણીમાં ચાર ચાર યુગ વીતી ગયા. મનુષ્ય અવતાર છેલ્લો છે તેમ માની જીવન સફળ કરજો. ચારયુગનું સરવૈયું કાઢજો. આ અવતારમાં કંઈ નહીં કરીએ તો લાખ ચોર્યાશી ફરીથી તૈયાર છે.

પરિક્ષિત રાજા સાત દિવસમાં માયા છોડી ભક્તિ કરી સ્વર્ગે સિધાવ્યા હતા. આપણે પણ માયા છોડી આત્મા માટે કંઈક કરવું પડશે. આપણાં કર્મો આપણી સાથે આવશે, કર્મોના જવાબ આપવા પડશે. દશરથ રાજાને શ્રવણની અજાણતાં હત્યા થઈ તો પણ તેને કર્મનું ફળ ભોગવવું પડ્યું હતું. કંસને પણ તેને જેવા કર્મ કર્યા તેવાં ફળ ભોગવવાં પડ્યાં હતાં. જીવનમાં સત્યનો સહારો લેવો. અસત્યનો સહારો લેનારની પડતી થાય છે. ભિષ્મે પાપી દુર્યોધનનો સહારો લીધો. તેનો વિનાશ થયો. અનીતિથી પતન થાય છે. ભગવાન ભાવનાના, પ્રેમના ભુખ્યા છે. હૃદયથી પ્રાર્થના કરશું તે અવશ્ય પ્રાર્થના સાંભળશે. દ્રૌપદીના ચિર હરાતાં હતાં ત્યારે દ્રૌપદી આર્તનાદથી પ્રાર્થના કરી, ભગવાનને આવવું પડ્યું.

આપણે જીવન એવું સંસ્કારી જીવીએ કે ઘરમાં સદા સંપ અને શાંતિ રહે. સંપ હશે તો ઘરમાં લક્ષ્મીનો વાસ થશે. સંસ્કારી જીવન હશે તો આપણા બાળકોમાં સારા સંસ્કાર આવશે. ઘરમાં સુપાત્ર પાકે તો કુળનો ઉધ્ધાર કરે, કુપાત્ર પાકે તો કુળનું નખ્ખોદ કાઢે છે. તમોએ અગિયાર દિવસ સત્સંગનો લાભ લીધો તે બદલ મારા સૌને આશીર્વાદ છે કે સૌનું કલ્યાણ થાય.

અંતમાં સત્સંગના વક્તા પ.પૂ. યોગતપોનિષ્ઠ શ્રી પ્રેમદાસબાપુ, પૂ. પંડિતશ્રી છગનભાઈ, કલાવૃંદ તથા સહયોગી કારસેવકો,

realpatidar.com

https://archive.org/details/bk1479/page/n31/mode/1up

realpatidar.com

મુંબઈના સ્વયંસેવકો, ભાવિક હરિભક્તો સૌને આભારસહ આશીર્વાદ પાઠવ્યા હતા.

બાદમાં આભારવિધિ કરતાં શ્રી કેશુભાઈ એમ. પટેલે (દુધાથલ) કહ્યું કે : સંતો આપણા માટે ખૂબ પરિશ્રમ ઉઠાવે છે તે એળે ન જાય. આપણે સૌ તેમનો આભાર માનીએ. કલાવૃંદ મુંબઈના સ્વયંસેવકો, લાઈટ ડેકોરેશન સંચાલકો, કારસેવકો, નામી અનામી સેવકોએ સેવાનો જે સહયોગ આપ્યો હોય તેમનો પણ આભાર માન્યો હતો.

અગિયાર દિવસના સત્સંગ સમારોહ પ્રસંગે શુભ શરૂઆત તથા પૂર્ણાહુતિ પ્રસંગે કાર્યક્રમનું સુંદર સફળ સંચાલન શ્રી જસુભાઈ કે. પટેલ (વિઠ્ઠલપુરા)એ કહ્યું હતું જે પ્રસંશનીય હતું.

અંતમાં સૌ હરિભક્તોએ ભાવવિભોર થઈ સંતોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લઈ આંતરભીના હૃદયે અગિયાર દિવસના સત્સંગની પૂર્ણાહુતિ કરી હતી.

●●●

નમ્ર નિવેદન

પ.પૂ. બ્રહ્મલીન ગુરુવર્ય સંતશ્રી રામદાસબાપુ ગુરુ હરજીવનબાપુના
-: શિષ્યમંડળ જોગ :-

આથી સમગ્ર ગુજરાત - કચ્છ તથા અખિલ ભારતભરમાં તેમજ દેશ-વિદેશમાં નિવાસ કરતા પ.પૂ. બ્રહ્મલીન ગુરુવર્ય સંતશ્રી રામદાસબાપુ ગુરુ હરજીવનદાસબાપુના શિષ્યોને જણાવવાનું કે આપણા સૌના હૃદયમાં બિરાજમાન, આપણી સૌની મુક્તિના માર્ગદર્શક, દિવ્યદૃષ્ટા પ.પૂ. ગુરુવર્ય સંત શ્રી રામદાસબાપુના શિષ્યોની એક જનરલ નામ-સરનામાની યાદી (નામાવલી) તૈયાર કરવાની હોવાથી આપ સૌ શિષ્યબંધુઓ તથા શિષ્ય-ભગિનીઓએ આપના રહેઠાણના નામ - સરનામાં, - ટેલીફોન નંબર - મોબાઈલ નંબર - દિક્ષા લીધેલ સ્થળ અને દિક્ષા લીધેલ વર્ષ સાથે વ્યક્તિગત નોંધ સહિત નીચે જણાવેલ સંપર્ક સ્થળે મોકલી આપવા કૃપા કરશો.

લિ. શ્રી અંબાલાલ શામજીભાઈ પટેલ - પ્રમુખશ્રી,
પ.પૂ. બ્રહ્મલીન ગુરુવર્ય સંતશ્રી રામદાસબાપુ શિષ્યમંડળ સેવા સમિતિ (ગુજરાત વિભાગ)

નોંધ :- નિવેદન છે કે શિષ્યબંધુઓ જેમ બને તેમ વહેલી તકે યાદી મોકલવા કૃપા કરશો.

સંપર્ક તથા સ્થળ :

(૧) શ્રી અંબાલાલભાઈ શામજીભાઈ પટેલ - પ્રમુખશ્રી - (ગુજરાત વિભાગ)
જ્યોતિ ઓટો એજન્સી, સ્ટેટ હાઈવે, ઉન્ડવા, મુ. પો. તા. ખેડબ્રહ્મા, જી. સાબરકાંઠા
(ઉત્તર ગુજરાત), પીન - ૩૮૩ ૨૫૫. મો. ૦૯૮૭૯૬૦૩૬૮૬

(2) Shree Hansrajbhai D. Gorani (Wise President)
302, Shree Nidhi Apartment, Kamla lane,
Ghatkopar (w) - MUMBAI - 400 086.
Tel. - 022 : 250 215 92, Mob. : 09223245080.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1479/page/n32/mode/1up

2010-09 -Satpanth Prakash (1479)

realpatidar.com

પ.પૂ. જગદ્‌ગુરુ સતપંથાચાર્ય શ્રી નાનકદાસજી મહારાજના આશીર્વાદ સહ..

ૐ પ્લાઝા હોલ ઉદ્‌ઘાટન સમારોહ

શ્રી અંધારિયા - કાછીયા જ્ઞાતિ - ભાવનગર, તા. ૨૧, ૨૨- ઑગષ્ટ -૨૦૧૦

- મધુભાઈ અંધારીયા, ભાવનગર.

સોરઠ ભોમની ધીંગી ધરામાં, હિલોળા લેતા મહાસાગરના કિનારે ભાવેણાના ઉપનામે શોભતું ભાવનગર શહેર. મીઠડી ધરાનાં મીઠડાં લોક, એના ભાવની તોલે, એના હેતની તોલે કોઈ ન આવે હોં. એવા માયાળુ માનવીના મલકમાં વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન થકી સતપંથના યુવાનોએ પરિશ્રમ કરી 'ૐ પ્લાઝા હોલ' (નવીન સમાજવાડી)નું નિર્માણ કર્યું છે.

આ 'ૐ પ્લાઝા હોલ' ના ઉદ્‌ઘાટન નિમિત્તે તા. ૨૧-૮-૨૦૧૦ના શુભ દિન ભાવેણાના ભાવે, સતપંથીઓના સ્નેહે, પ્રેરણાપીઠ પીઠાધિશ્વર પ.પૂ. જગદ્‌ગુરુ શ્રી નાનકદાસજી મહારાજ, પ.પૂ. યોગતપોનિષ્ઠ શ્રી પ્રેમદાસબાપુ તથા સહયોગી મહાનુભાવોની પધરામણી બપોરના ૧૨:૩૦ કલાકે ભાવનગરના શ્રી વિજયભાઈ અંધારિયાને ગૃહે થઈ. ત્યાં બે કલાક વિશ્રામ કર્યા બાદ સૌ સંતોનાં ૨:૩૦ કલાકે શ્રી અંધારિયા - કાછીયા જ્ઞાતિની વાડી (જુની માણેકવાડી) સ્થાનકે વાજતે ગાજતે ઉમળકાભેર ઘડીવાળી દીકરીઓ સહ સ્વાગત સામૈયાં કરવામાં આવ્યાં. ત્યારપછી શોભાયાત્રા સ્વરૂપે જુની માણેકવાડી (જુની સમાજવાડી)થી પ્રસ્થાન થઈ ૪:૩૦ કલાકે 'ૐ પ્લાઝા હોલ' (નવીન સમાજવાડી) સ્થાનકે શોભાયાત્રા પૂર્ણ થયા બાદ ધર્મસભામાં પરિવર્તિત થઈ હતી. ત્યાં સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સંતો મંચસ્થ બિરાજમાન થયા હતા. મંચસ્થ બિરાજમાન સંતોના ચરણામૃત, ચંદન-તિલક, આરતી કરવામાં આવ્યાં. સંતોના સ્વાગત નિમિત્તે ગામની નાની - નાની બાળાઓ દ્વારા પ્રાર્થના અને શ્રી ગીરીશભાઈ અંધારિયા દ્વારા સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે **શ્રી રાજુભાઈ અંધારિયાએ** શાબ્દિક સ્વાગત કરતાં કહ્યું કે : અમારા આ મંગલ કાર્યક્રમને આશીર્વાદ સહ સફળ બનાવવા પ.પૂ. જગદ્‌ગુરુશ્રી નાનકદાસજી મહારાજ તથા પ.પૂ. યોગતપોનિષ્ઠ શ્રી પ્રેમદાસબાપુ તેમજ મહાનુભાવો પ્રેરણાપીઠ પીરાણાથી પધાર્યા છે તેમનું હું હૃદયપૂર્વક સ્વાગત કરૂં છે. આપ સૌ ગ્રામજનો પણ પ્રસંગને શોભાવવા પધાર્યા છો તેમનું પણ સ્વાગત કરું છું.

સમયના વહેણ સાથે રહીને પ્રગતિ કરવી એ કાછીયા જ્ઞાતિની આગવી ઓળખ છે. સંતોના સાનિધ્યમાં ખભેખભા મિલાવી આજે આ આધુનિક હોલનું ઉદ્‌ઘાટન થઈ રહ્યું છે. આ હોલ વિચારભેદ ભૂલી સૌનો ભાતૃભાવના પ્રતિક સમાન બની રહેલ છે. સૌના સાથ અને સહકારથી આધુનિક હોલ બનાવવાનું સ્વપ્ન સાકાર થઈ રહેલ છે. આ હોલ બનાવવામાં વડીલોની દીર્ઘદૃષ્ટિ આભારી છે. આ આધુનિક એરકંડીશન હોલની જે આવક થશે તે જ્ઞાતિના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે, આર્થિક રીતે અસમર્થ લોકોને આરોગ્યની સારવાર માટે અને જરૂરિયાતમંદને આર્થિક સહાય માટે ઉપયોગમાં લેવાશે. આ હોલના નિર્માણમાં કાર્યકર્તાઓની સેવાને વિશેષ રીતે બિરદાવીએ છીએ. તેમના સમય, નાણાં અને વિચારોની જરૂર કાયમ રહેતી હોય છે. આયોજકો વહીવટી કમિટી, બાંધકામ કમિટી અને જેમને સમય તથા નાણાંનો સહયોગ

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1479/page/n33/mode/1up

realpatidar.com

આપ્યો છે તેમને આ પ્રસંગે યાદ કરી બિરદાવીએ છીએ.

શ્રીમતી રંજનબેન અંધારિયાએ આ પ્રસંગે જણાવ્યું કે : આવો અદ્દભૂત હોલ બનાવવાનું યુવા પેઢી તથા વહીવટી કમિટીના સહયોગથી સ્વપ્ન સાકાર થયું છે. આ કાર્ય સમાજ જ્ઞાતિના હિત માટે છે. પરસ્પરના ભેદભાવ ભૂલી સૌ ગૌરવભેર સહકાર આપે. આ કાર્યના નિર્માણમાં યુવા પેઢી પર જે ભાર છે તે ભાર ઉતારવાની દરેકની ફરજ છે.

આ પ્રસંગે પ.પૂ. યોગતપોનિષ્ઠ શ્રી પ્રેમદાસબાપુએ તેમની વાણીમાં કહ્યું કે : આપનો ભાવ જોઈ પ.પૂ. જગદ્‌ગુરુ શ્રી નાનકદાસજી મહારાજ પધાર્યા છે. આવો અદ્યતન હોલ ટૂંક સમયમાં તૈયાર કર્યો તે ધન્યવાદને પાત્ર છે. વડીલોના વિચાર અને યુવાનોની મહેનતનું આ પરિણામ છે. વડીલો આંખ છે જ્યારે યુવાનો પાંખ છે. વડીલોમાં અનુભવ છે જ્યારે યુવાનોમાં કામ કરવાની શક્તિ છે. બંનેના સહયોગથી સ્વપ્ન સાકાર થયું છે. પરમાત્માએ ધન આપ્યું હોય તો આવા સારા રસ્તે ઉપયોગ કરજો. દૈવી સંપત્તિથી જ આવાં સરસ કાર્યો થાય છે. એક ઘણું દાન અને સહસ્ર ઘણું પુન્ય. આપણી કમાણીમાંથી ભગવાનનો ભાગ કાઢજો અને આવા સત્કાર્યમાં ઉપયોગ કરજો. સદ્‌ગુરુ શ્રી ઈમામશાહ મહારાજે કહ્યું છે કે હાલ અને માલની દશાંદ આપજો. ભગવાનનો ભાગ ન કાઢીએ તો દારિદ્ર આવે. ભગવાને આપણને સત્કર્મ માટે મોકલ્યા છે.

કલિયુગમાં સંગઠન શક્તિથી જ પ્રગતિ થાય છે. અંધારિયા કાછીયા સમાજે હાથ મિલાવી 'ૐ પ્લાઝા હોલ' બનાવ્યો છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. જે ભાવે એકત્રિત થઈ આ ભગીરથ કાર્ય કર્યું છે તે ભાવ કાયમ રહે. ભાવી પેઢી આપણા કાર્યને જોઈ રહી છે તે ભવિષ્યમાં જરૂર પ્રેરણા લેશે અને વડીલોને યાદ કરશે. પ.પૂ. જગદ્‌ગુરુ મહારાજના આશીર્વાદ અને શુભ મનોકામનાથી આ કાર્ય જલદી સફળ થયું છે. બ્રહ્મલીન પ.પૂ. શ્રી કરસનદાસજી મહારાજે ક્રાંતિ આપી તેથી સતપંથ સમાજની પ્રગતિ થઈ. જે સમાજ નિર્વ્યસની અને સુસંસ્કારી હોય તેની અવશ્ય પ્રગતિ થાય છે. પ્રેરણાપીઠથી જે આદેશ થાય તેનું પાલન કરવું આપણી પવિત્ર ફરજ છે. મોબાઈલમાં જે કંપનીનું સીમકાર્ડ હોય તે ટાવર દ્વારા વાત થાય. આપણી પાસે શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનનું સિમકાર્ડ અને ટાવર છે. તેના થકી પરમાત્માને પામી શકાશે.

હર્ષદભાઈ વકીલ અણમોલ હીરાની કડી સમાન છે તેમને આ કાર્યમાં વિશેષ સહયોગ રહ્યો છે. અંતમાં જેમને જેમને તન મન અને ધનથી સહયોગ આપ્યો છે તેમને આશીર્વાદ સહ આપ સૌનું જીવન ધન્ય બને એજ અભિલાષા.

પ.પૂ. જગદ્‌ગુરુ સતપંથાચાર્યશ્રી નાનકદાસજી મહારાજે તેમની ભાવસભર દિવ્ય વાણીમાં કહ્યું કે : તમારા સૌનો ભાવ જોઈ સમાજવાડીના ઉદ્‌ઘાટન પ્રસંગે આવ્યા છીએ. તમારું આ કાર્ય આ એ.સી. સમાજવાડી જોઈ મારી છાતી ગજ ગજ ફૂલી જાય છે. સમાજની એકતા વગર આ ભગીરથ કાર્ય શક્ય નથી. તમારી એકતાને તમારા કાર્યને ધન્યવાદ છે. એક વિચારથી જ આવું ભગીરથ કાર્ય શક્ય બન્યું છે. 'ૐ પ્લાઝા હોલ' (સમાજવાડી)ની જે આવક થશે તે સદ્દકાર્યમાં વપરાશે તે સાંભળી આનંદ થયો. ધનનો સત્કાર્યમાં ઉપયોગ કરવો જોઈએ. ધનને તિજોરી કે બેંકમાં રાખી મુકશું તો તે રાખ બરાબર છે. પણ તેને સત્કાર્યમાં ઉપયોગમાં લેશું તો લાખ બરાબર છે. પરમાત્માના દરબારમાં સત્કર્મ સાથે આવશે. આપણા જીવનના અંતિમ દિવસે આખા જન્મના કર્મો યાદ આવે છે. દિવ્ય ચક્ષુ ખુલે છે અને જેટલાં જીવનમાં પાપ-પુન્ય કર્યાં હોય તે નજર સમક્ષ

realpatidar.com

https://archive.org/details/bk1479/page/n34/mode/1up

2010-09 -Satpanth Prakash (1479)

realpatidar.com

દેખાય છે. જીંદગીમાં શું કર્યું તે સામે ચિત્ર દેખાય છે. પાપો કર્યા હશે તો વિકરાળ મોં ફાડીને સામે આવીને ઊભાં રહેશે. અને અફસોસ થશે કે મેં જીવનમાં કંઈ જ ન કર્યું. જીવનમાં સત્કર્મ ન થાય તો કંઈ નહીં પણ પાપકર્મ ન થાય. દશરથ રાજાને પણ અંતિમ સમયે શ્રવણનાં મા-બાપ દેખાતાં હતાં. તેનાથી અજાણતાં બ્રહ્મહત્યા થઈ ગઈ હતી તો પણ તેમને તેનું ફળ ભોગવવું પડ્યું હતું. ચાર ચાર દીકરા છતાં પુત્ર વિયોગે તેમને પ્રાણ ત્યાગવાનો સમય આવ્યો. જેવાં કર્મ કરીએ તેવાં ફળ અવશ્ય ભોગવવાં પડે છે. સદ્‌ગુરુ શ્રી ઈમામશાહ મહારાજે તેમના ઉપદેશમાં કહ્યું છે કે :

"અનીતિસે ધન હોત હૈ, વરસ પાંચ સાત સાલ,
તુલસી દ્વાદસ વર્ષમેં, જડમૂળસે નીકલ જાય."

નીતિથી કમાજો, નીતિથી રહેજો. તમે તો મહેનતુ છો. પરસેવાના પૈસાથી આ નવીન સમાજવાડીનું નિર્માણ કર્યું છે. વડીલો, માતાઓ, દીકરાઓ, દીકરીઓ જેને જેને આ નવીન સમાજવાડીના નિર્માણમાં સેવાનું કે ધનનું યોગદાન આપ્યું છે તેમને મારા આશીર્વાદ છે. નવધા ભક્તિમાં સેવા અને નામસ્મરણ ભક્તિ વિશેષ છે. શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનનું નામ સ્મરણ ચોર્યાસીના ફેરામાંથી મુક્તિ અપાવશે. શબરીમાં નવધા ભક્તિ હતી પણ તેમાંય નામસ્મરણ અને સેવા ભક્તિ વિશિષ્ટ હતી. તેની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શ્રી રામે શબરીને દર્શન આપી ઉધ્ધાર કર્યો.

આપણે પણ ભગવાન શ્રી નિષ્કલંકી નારાયણની ભક્તિ ઉપાસના કરીએ છીએ. ભગવાન એક દિવસ જરૂર આવશે. દર્શન આપશે અને આપણી મનોકામના પૂર્ણ કરશે. સદ્‌ગુરુએ પણ આપણને નામસ્મરણની ભક્તિ કરવાની કહી છે જે શ્રેષ્ઠ છે. શરીર સુખ માટે ગાડી, વાડી, બંગલા છે પણ આત્માના કલ્યાણ માટે શું કર્યું ? તે વિચારજો. સદ્‌ગુરુશ્રીએ કહ્યું છે કે "દિન પર્તે કરો ધામ શું ધંધા, સાંજ પડે થાવ સાહેબકા બંદા" નાયાકાકા, ભાભારામ, કીકીબાઈ, નરસિંહ મહેતા, મીરાંબાઈ, ભક્ત બોડાણો, સંત તુકારામ, ગોરો કુંભાર સૌ નામ સ્મરણથી ભવસાગર તરી ગયા. હાજરવીર, શાણાકાકા સેવા ભક્તિથી મોક્ષપદ પામ્યા છે. જીભ નવરી હશે તો પાપકર્મ કરશે. એક બીજાની નિંદા કરશે. તેને ભગવાનના નામ સ્મરણ સાથે હરતાં ફરતાં કામ કરતાં જોડી દો. દીકરીઓ, માતાઓ તમે પણ રસોઈ બનાવતાં બનાવતાં ભગવાનનું નામ સ્મરણ કરજો. નામ સ્મરણથી જે રસોઈ બનશે તેમાંથી પરિવારમાં સંસ્કારનું, ધર્મનું ભાથું પિરસાશે. બાળકો સંસ્કારી બનશે. સાચી મૂડી નામ સ્મરણ છે. નિત નિત નામ સ્મરણ કરજો. ભગવાન સાથે રહેશે. ભગવાન રક્ષા કરશે. મનુષ્ય અવતાર વારંવાર નહીં મળે. ચોર્યાશીનો ફેરો મટાડવા આવ્યા છીએ. ઉચ્ચ કુળમાં અવતાર મળ્યો છે. પૂર્વભવમાં સારી કમાઈ કરી હશે તેથી મનુષ્ય અવતાર મળ્યો છે. મનુષ્યમાંથી ભક્તિ કરીને દેવ બનાય છે. ભાગ્યશાળીને સામાન્ય ટકોર લાગી જાય તો પણ જન્મારો સફળ થઈ જાય છે.

જ્ઞાતિના વહીવટકર્તા વહીવટ ચોખ્ખો રાખશે તો સમાજની પ્રગતિ અવશ્ય થશે જ. સમાજનો વિકાસ થાય તેવા મારા આશીર્વાદ. આજે તેત્રીસ કોટિ દેવોનું મહાપૂજન કરી આહ્‌વાન કરી આ સમાજવાડીના હોલને પવિત્ર બનાવ્યો છે. દેવોના આશીર્વાદ મેળવ્યા છે. દેવોના અહીં પગલાં થયાં છે. ભટકતા જીવાત્મા, કે જીવજંતુથી અપવિત્ર થયેલ ભૂમિ શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન અને દેવોના સ્પર્શથી પવિત્ર થઈ છે. આજે રીબીન કાપી 'ૐ પ્લાઝા હોલ' નું ઉદ્‌ઘાટન કર્યું છે. મારા શુભ આશીર્વાદ છે કે સંસ્થાનો વહીવટ બરાબર ચાલે અને સમાજ (જ્ઞાતિ)ની પ્રગતિ થાય. સમાજવાડી સમાજને અને બીજાને પણ ઉપયોગી થાય.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1479/page/n35/mode/1up

realpatidar.com

અનુષ્ઠાન તથા સત્સંગ સમારોહ - કુકસ

તા. ૨૬-૭-૨૦૧૦ થી તા. ૫-૮-૨૦૧૦

- શ્રી અરવિંદભાઈ, કુકસ.

સદ્‌ગુરુ શ્રી ઈમામશાહ મહારાજ તેમજ પ.પૂ. જગદ્‌ગુરુ શ્રી નાનકદાસજી મહારાજની પ્રેરણાથી પ.પૂ. લાડીલા મહંતશ્રી શીવરામદાસજી મહારાજની અસીમકૃપાથી અમારા કુકસ ગામે અનુષ્ઠાન તથા સત્સંગનો સમારોહ તા. ૨૬-૭-૨૦૧૦ થી ૫-૮-૨૦૧૦ સુધી અગિયાર દિવસનો ભવ્ય કાર્યક્રમ યોજાયો.

કાર્યક્રમની શરૂઆત થઈ તે અગાઉ સૌ ભક્તજનો અનુષ્ઠાનથી અજાણ હતા. જેથી ઘણા ઉત્કંઠાસહ કાર્યક્રમમાં ભાગ લીધો અને સહયોગ આપ્યો. કાર્યક્રમમાં શરૂઆતના દિવસથી જ પ.પૂ. મહંતશ્રી શીવરામદાસજી મહારાજે સતપંથી ભક્તજનોના હૃદયમાં સ્થાન મેળવી લીધુ હોય તેવો ભાસ થયો. તેમણે સતપંથ ધર્મની વિશેષતા, પૂજાનું મહત્વ, દરેક દરેક મંત્રની વિશિષ્ઠતા, ધર્મનું મહત્વ, સતપંથ ધર્મ વૈદિક ધર્મ છે ને છે જ તેની દરેક ભક્તજનોને પ્રતીતિ કરાવી.

સત્સંગ સમારોહમાં એક દિવસે પૂજ્ય શ્રી છગનબાપાએ સત્સંગમાં પ્રવક્તા રહી દરેક દરેક શબ્દનો અર્થ ખૂબ જ છણાવટથી સમજાવ્યો. અમને બધાને એવું થયું કે પૂ. શ્રી છગનબાપા ભવિષ્યમાં તેમની અમૃતમયવાણીનો લાભ અમને આપશે તો અમારું અહોભાગ્ય રહેશે. પ.પૂ. મહંતશ્રી શીવરામદાસજી મહારાજે સતપંથમાં અનુષ્ઠાન - સત્સંગનું મહત્વ છે તે ખૂબ સરળ ભાષામાં સમજાવ્યું.

અનુષ્ઠાનમાં સત્સંગમાં અમુક મુદ્દાઓની અવારનવાર ખૂબ જ ચીવટ રાખવામાં આવી. મંદિરની પવિત્રતા જાળવવા ગુટખા, છીંકણી, અફીણ, જેવા પદાર્થોનો ત્યાગ કરાવવા વ્યસનમુક્તિનો કાર્યક્રમ રાખ્યો હતો.

આ કાર્યક્રમમાં ભક્તજનોએ વ્યસન ત્યજવાના શપથ લીધા. અમારા એક ટ્રસ્ટીશ્રી વિઠ્ઠલભાઈએ તો સંકલ્પ લીધેલો તેની અમને જાણ કરતાં ભક્તજનો ખૂબ ખૂબ રાજી થયા.

સત્સંગમાં રૂપાંદે-માલદે, એકનાથ, નરસિંહ મહેતા, ઉગમસીબાપુ, અષ્ટાવક્રઋષિ, ગુરુશિષ્યના અનેક પ્રસંગો, જનકરાજા, મહાત્મા કબીર, જુની-નવી ચોપડી વિશેની સાચી સમજને લગતાં દૃષ્ટાંત, મા-દીકરીના સંબંધનું મહત્ત્વ, પંચામૃતની સમજ, અકબર-બીરબલના પ્રસંગો, મૂળદાસના પ્રસંગોની સવિસ્તાર માહિતી સાંઈબાબાના મંદિરની સ્વચ્છતાના દૃષ્ટાંતથી આપણા મંદિરની સ્વચ્છતા, સાચું દર્શન કરવાની રીત, સંત મહાત્મા પ્રત્યેની આપણી ફરજ, યોગાભ્યાસ, મંત્રોનું ઉચ્ચારણ, નામ સ્મરણ મહીમા, દશોંદ વિશેની સાચી સમજ, ગુરુમંત્રનું મહત્ત્વ, ઘર મંદિર બનાવવા અંગેની સાચી સમજણ આપી તે ખૂબ ગમી. શિષ્યની ભૂલો, ગુરુજીની જવાબદારીના પ્રસંગો, ધોબી - ઘાંચીના દૃષ્ટાંતથી સમજ, ટેક - સંકલ્પ, અષ્ટાવક ઋષિની પિતાને સમજ આપવાની રીત, આપણી ઈન્દ્રિયોની સમજ ઉદાહરણો દ્વારા, દીકરીની ત્યાગ ભાવના, ગોરખનાથ - મછંદરનાથ - ભરથરીનાં દૃષ્ટાંત, કબીરજીનો દાખલો, હરિપ્રસાદ સ્વામીનો પ્રસંગ, આપણા સતપંથ ધર્મના અનેક દાખલાઓ દલીલો, ભક્તજનોને મુંઝવતા પ્રશ્નોનો સરળ ઉકેલ, જલારામ બાપાનો પ્રસંગ, બાપા સીતારામના

realpatidar.com

https://archive.org/details/bk1479/page/n36/mode/1up

2010-09 -Satpanth Prakash (1479)

realpatidar.com

અંધારિયા સમાજનો વિકાસ થતો જાય છે અને વધારે વિકાસ થાય. તેવા મારા આશીર્વાદ છે. સમાજમાં એકતા હશે તો પ્રગતિ થશે જ. આંતરિક ઘર્ષણ પાછળની પેઢીમાં અસંતોષ પેદા કરે છે. જીવનમાં અમૃતનાં બીજ વાવવાં છે "એક લાકડી ભાંગી જશે, ભારી નહીં ભાંગે" નાના મોટા કોઈ વિખવાદ હોય તો ભૂલી જજો. સમાજનાં ઘણાં કામ કરવાનાં બાકી છે. નવી પેઢી સંસ્કારી બને તેવા સંસ્કાર આપજો અને સતપંથની શાન જાળવી રાખજો.

'ૐ પ્લાઝા હોલ' ના બાંધકામમાં જે દાતાઓએ યોગદાન આપ્યાં હોય, કોઈએ ધનનાં, કોઈએ સેવાનાં, કોઈએ બ્રહ્મભોજનનાં યોગદાન આપ્યાં હોય તેમને મારા અંતઃકરણના આશીર્વાદ છે. ભગવાન શ્રી નિષ્કલંકી નારાયણ તમ સૌની પ્રગતિ કરે. તેવી શુભેચ્છા. બ્રહ્મ પ.પૂ. આદ્ય જગદ્‌ગુરુ શ્રી કરસનદાસજી મહારાજે આપણા માટે સોનાનો સૂરજ ઉગાડ્યો છે તેને સાર્થક કરીએ. સમગ્ર કાર્યક્રમના સંચાલકો, સ્વયંસેવકો, સેવાધારીઓને મારા આશીર્વાદ છે.

આ પ્રસંગે એડવોકેટ શ્રી હર્ષદભાઈ નાનચંદભાઈ અંધારિયાનો 'ૐ પ્લાઝા હોલ' નિર્માણમાં સહયોગ વિશેષ રહ્યો હોવાથી તે નિમિત્તે પ.પૂ. જગદ્‌ગુરુ શ્રી નાનકદાસજી મહારાજે તેમના વરદ્ હસ્તે આશીર્વાદ સહ શાલ ઓઢાડી તેમનું સન્માન કર્યું હતું. ●●●

ગુરુપૂર્ણિમા મહોત્સવ - કુકસ

શ્રી નાયાકાકા મહારાજ સંસ્થાન - કુકસ - તા. ૨૫-૭-૨૦૧૦

શ્રી નાયાકાકા મહારાજ મંદિર - કુકસ ગામે પ.પૂ. મહંતશ્રી શીવરામદાસજી મહારાજના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાના ભવ્ય પ્રસંગે સવારના ૮:૦૦ કલાકે પાદૂકા પૂજન, ફૂલહારવિધિ, મહાપૂજા તથા આરતીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ પ્રસંગનો લાભ ૭૦૦ થી ૮૦૦ સતપંથી ભક્તોએ લીધો હતો. છેલ્લે દરેક ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લઈ અવસરનું સમાપન કર્યું હતું. ●

સત્સંગ કાર્યક્રમ

શ્રી નાયાકાકા મહારાજ સંસ્થાન - કુકસ - તા. ૧૪-૮-૨૦૧૦

- સંજયભાઈ દોલાભાઈ પટેલ - કુકસ

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના કુકસ ગામે શ્રી નાયાકાકા મહારાજનું મંદિર આવેલું છે. પ્રાત: વંદનીય શ્રી નાયાકાકા મહારાજ મંદિરના પટાંગણમાં વંદનિય પ.પૂ. મહંત શ્રી શીવરામદાસજી મહારાજના સાનિધ્યમાં ફૈજપુર (મહારાષ્ટ્ર)ના પ.પૂ. સંત શિરોમણી શ્રી જનાર્દનજી મહારાજની નિશ્રામાં એક સત્સંગ સમારોહ તા. ૧૧ તથા ૧૨ ઑગષ્ટ, ૨૦૧૦ના રોજ યોજાઈ ગયો. વ્યાસપીઠ ઉપર પ.પૂ. શ્રી શીવરામદાસજી મહારાજના શુભ આશિષ અને દીપ પ્રાગટ્ય બાદ સંતોનો સત્કાર કરવામાં આવ્યો. બાદમાં ગુરુવંદનાથી સત્સંગનો પ્રારંભ કરાવાયો. વંદનીય પ.પૂ. મહંતશ્રી જનાર્દનજી મહારાજ દ્વારા પૃથ્વીની ઉત્પત્તિ અને સતપંથ ધર્મનો પ્રાદુર્ભાવથી લઈને સદ્‌ગુરુ શ્રી ઈમામશાહ મહારાજ દ્વારા પ્રચાર, પ્રસાર દ્વારા થયેલ સતપંથ ધર્મની વિશેષ સમજ કથાકીય સંત દ્વારા અસ્મરણીય શબ્દોમાં પ્રવાહીત કરવામાં આવી. સતપંથી હરિભક્તોને સતપંથ વિશે ગહન ઉંડાણમાં વિસ્તૃત સમજ આપી લોકોને ભાવવિભોર બનાવ્યા.

અંતમાં શ્રી નાયાકાકા મહારાજ સંસ્થાન - કુકસના પ.પૂ. મહંતશ્રી શીવરામદાસજી મહારાજ દ્વારા વ્યસનમુક્તિ અને દશાંશના ફાયદા વર્ણાવી આ ધર્મમાં દશાંશનું મહત્વ સમજાવ્યું. જેના પ્રતિસાદ રૂપે હરિભક્તો દ્વારા સ્થળ ઉપર દશાંશ અર્પણનો કાર્યક્રમ યોજાયો. વિવિધ વિસ્તારમાંથી આવેલ સતપંથી દ્વારા આ કાર્યક્રમને ઉત્કૃષ્ઠ પ્રતિભાવ મળ્યો.

સભા સંચાલન અરવિંદભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.

●●●

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1479/page/n37/mode/1up

realpatidar.com

દાખલા, સેવાનો અહંકાર ન હોઈ શકે તેની સમજ.

ઉપર જણાવેલ દૃષ્ટાંત સિવાયનાં દૃષ્ટાંત પણ પ.પૂ. મહંતશ્રી શીવરામદાસજી મહારાજે આપીને દશે દશ દિવસ સત્સંગના રંગમાં રંગી દીધા. એ ભક્તજનો માટે ખૂબ આનંદનો અવસર કહી શકીએ તો તે ખૂબ જ ઉચીત છે.

છેવટે છેલ્લા દિવસે પૂર્ણાહુતિ કાર્યક્રમ સમયે ભક્તજનોમાં ટૂંક સમય માટે છૂટા પડવાની પળ ઘણી જ કરૂણામયી રહી.બાપા તેમજ ભક્તજનો દરેકના નયનોમાં અશ્રુધારા હતી.

સત્સંગ સમયે બ્રહ્મભોજનના દાતાઓ વડોદરાના, સુરતના, કુકસ, અવાખલ, વેમાર, પુનિયાદ, મેવાસ, ખંભાત જેવા અનેક સ્થળેથી ભક્તજનોએ ભાગ લઈને જે સહયોગ આપેલો છે તે ખરેખર આદરણીય છે.

અંતમાં અમે સર્વ ભક્તજનો અમારા નાયાકાકાના મંદિરના ગાદીપતિ પ.પૂ. મહંતશ્રી શીવરામદાસજી મહારાજના જેટલા ગુણ ગાઈએ તેટલા ઓછા છે. સદ્‌ગુરુ શ્રી ઈમામશાહ મહારાજની કૃપા, પ.પૂ. શ્રી શીવરામદાસજી મહારાજ ઉપર અટલ રહે. પ.પૂ. જગદ્‌ગુરુ શ્રી નાનકદાસજી મહારાજની અમીદૃષ્ટિ અને બ્રહ્મલીન પ.પૂ. સંતશ્રી રામદાસબાપુની કૃપા પ.પૂ. યોગતપોનિષ્ઠ શ્રી પ્રેમદાસબાપુની કૃપા તથા અન્ય સંતો - મહંતોની કૃપાદૃષ્ટિથી અમારું નાયાકાકા મહારાજનું મંદિર મીની પીરાણા ટૂંક સમયમાં બને અને અમે સાચા અર્થમાં સાચા સતપંથી બની સતપંથ ધર્મની જ્યોતનો ડંકો વિશ્વમાં ફેલાય તેવી શક્તિ અમને તથા અમારા ગુરુશ્રી પ.પૂ. મહંતશ્રી શીવરામદાસજી મહારાજને ખૂબ શક્તિ અને લાંબુ આયુષ્ય મળે તેવી અમારા ભક્તજનોની હૃદયની લાગણી છે.

અનુષ્ઠાનના પૂર્ણાહૂતિ પ્રસંગે પ.પૂ. મહંતશ્રી શીવરામદાસજી મહારાજનું વડોદરાના શ્રી હિમ્મતભાઈએ આરતી ઉતારી અને અનુષ્ઠાનના બ્રહ્મભોજનના રામભરોસે દાતા વતી શ્રી વેલજીભાઈએ ફુલહારથી સ્વાગત કર્યુ અને અનુષ્ઠાનના અંતે સર્વે ભાવિક ભક્તો તથા મહાનુભાવોનું સંસ્થાના ટ્રસ્ટીશ્રી વિઠ્ઠલભાઈ પટેલે આભારવિધિ કરી. અનુષ્ઠાનનું સમાપન કર્યું.

<u>**વિશેષ માહિતી :**</u>

<u>**પ.પૂ. મહંતશ્રી શીવરામદાસજી મહારાજ**</u>નું સ્તુત્ય કાર્ય. (૧) પગરખાં ઉતારવાની યોગ્ય જગ્યા નક્કી કરી માર્ગદર્શન. (૨) રવિવાર, ગુરુવારે અન્નક્ષેત્ર ચાલુ કરવાની શુભ શરૂઆત (૩) સભાખંડમાં ભક્તજનોને એકચિત્તે એકદોરે બાંધી રાખવાની ક્ષમતા. (૪) મંદિરમાં સુધારા માટેની શુભ ભાવના. (૫) મંદિરને જરૂરી મોટા સભાખંડ બનાવવાની મહેચ્છા દાતાઓ દ્વારા. (૬) મંદિરમાં જરૂરી રસોડાઘરની સુવિધા વધારવાની લાગણી (૭) દરેક ભક્તજનો પ્રત્યેની એક સરખી દૃષ્ટિ (૮) દાન-દક્ષિણા ચરણમાં આવેલી રકમ ઉપરનો તેમને મોહત્યાગ ખરેખર વંદનીય છે. (૯) મંદિરમાં દર્શન કરીને સ્ત્રીઓને મહારાજશ્રીના રૂમમાં આવવા માટેની સાચી સમજણ સ્તુત્ય લાગે છે. (૧૦) ધર્મ પ્રચારની ભાવના સતપંથ શાસ્ત્રના પુસ્તકનું વિતરણ કરી સતપંથ ધર્મ પ્રત્યેની લાગણી ખરેખર અભિનંદનીય છે. પ.પૂ. મહંતશ્રી શીવરામદાસજી મહારાજની ગુરુદેવો પ્રત્યેની લાગણી તો અમને ખરેખર ખૂબ ગમી છે. વારંવાર ગુરુદેવને યાદ કરી અમને માર્ગદર્શન આપવાની સાચી સમજ વંદનીય છે.

પ.પૂ. મહંતશ્રી શીવરામદાસજી મહારાજ આપના નેજા હેઠળના મંદિરની પ્રગતિ અને આપની પ્રગતિ ઉત્તરોત્તર વધે એવી ભક્તજનોની લાગણી છે. ●

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1479/page/n38/mode/1up

realpatidar.com

શ્રધ્ધાંજલી



સ્વ. શ્રી કેશરાભાઈ હીરજીભાઈ છાભૈયા

સ્વર્ગવાસ તારીખ : ૦૪-૦૮-૨૦૧૦, ઉંમર : ૧૦૫ વર્ષ

ગામ: કોલિયાણવાડી (મોટી રાયણ - માંડવી - કચ્છ)

"હશે કોઈ પુણ્ય અમારાં, અમોને સંગાથ મળ્યો તમારો,
જન્મો જન્મ મળજો તમો, હે માવતર ! કોટી કોટી વંદન તમોને અમારાં."

અમારા જીવનના ઘડવૈયા ! તમો જીવનભર પરિશ્રમના દિવસો વિતાવી નિઃસ્વાર્થ રહી, જીવનમાં કર્મનિષ્ઠ, ધાર્મિક અને વૈદિક વિચારસરણીની પ્રવૃત્તિ નિષ્ઠાપૂર્વક નિભાવી અને પરોપકારના સદ્‌ગુણોને આત્મસાત કરી, વૈદીક સંસ્કાર સિંચનથી સમગ્ર પરિવારની વાડીને લીલીછમબનાવી, વ્યવહારિકાતો માર્ગ ચિંધનાર આપે સમગ્ર પરિવાર માટે પરિશ્રમકરી સુંખ-સમૃધ્ધિનો મહાસાગર મુકતા ગયા. આપે ચિંધેલા સંસ્કારો અમોને હંમેશાં પ્રેરણા આપતા રહેશે. આપના ચિંધેલા માર્ગ અને કંડારેલી કેડી પર તમારા આશીર્વાદ સાથે સદૈવ તત્પર રહીએ. અમે આવા પુણ્યશાળી આત્માને સમગ્ર કોલિયાણ વાડી છાભૈયા પરિવાર ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરીએ છીએ.

"મળે છે દેહ માટીમાં પણ માનવીનું નામ જીવે છે,
મૃત્યુ પામે છે માનવી પણ તેના સત્કર્મો જીવે છે."

લી.

દેવજી કેશરા છાભૈયા - શિવગણ કેશરા છાભૈયા
શામજી કેશરા છાભૈયા (મંત્રી - કચ્છ સતપંથ સેવા સમિતિ)
તથા સમસ્ત છાભૈયા પરિવાર. હ. નિતેશ છાભૈયા - મો. ૦૯૪૨૬૨ ૧૭૬૮૫
કોલિયાણ વાડી, મોટી રાયણ, માંડવી - કચ્છ.

realpatidar.com

https://archive.org/details/bk1479/page/n39/mode/1up

2010-09 -Satpanth Prakash (1479)

Premitted to post at BAREJA No. 10th EM under postal regd. No. GUJqGNR-238,
issued by ssp Gandhinagar - 382 010.
Valied up to 31-12-2011, RNI No. GUJ/2006/11664



અમરદીપ
હોમિયો કેર હોસ્પિટલ

ડૉ. કિરીટ એમ. પટેલ
B.H.M.S.
હોમીયોપેથીક કન્સલટન્ટ

કોમ્પ્યુટરાઈઝડ હોમિયોપેથીક હોસ્પિટલ

મોડાસા	: બાલાજી કોમ્પ્લેક્ષ, માલપુર રોડ	બુધવાર તથા રવિવારે રજા રહેશે.	(સવારે ૯ થી ૧ સાંજે ૪ થી ૭)
હિંમતનગર	: આસ્થા ફિઝીયોથેરાપી સેન્ટર	દર મહિનાનો પહેલો તથા ત્રીજો બુધવાર	(બપોરે ૨:૩૦ થી ૬:૩૦)
ખેડબ્રહ્મા	: ડૉ. વસંત પટેલનું દવાખાનું	દર મહિનાનો બીજો બુધવાર	(સવારે ૧૦:૩૦ થી ૩:૩૦)
બાયડ	: ગુરૂકૃપા ડેન્ટલ ક્લિનીક	દર મહિનાનો ચોથો બુધવાર	(બપોરે ૩:૦૦ થી ૬:૩૦)
સાઠંબા	: ડૉ. ભુપેન્દ્ર પટેલનું દવાખાનું	દર મહિનાનો ચોથો બુધવાર	(સવારે ૯:૩૦ થી ૧:૩૦)

Mo. 97244 23111, 02774-242635

Printed Book

રવાના :
સતપંથ પ્રકાશ
સતપંથ પ્રકાશન સમિતિ
પ્રેરણાપીઠ, પીરાણા, તા. દસક્રોઈ,
જિ. અમદાવાદ – ૩૮૨ ૪૨૫

To, ____________________

____

____

____

realpatidar.com